



શ્રી આત્માનંદ પ્રકાશ

કાયા, કંચન, ડામિની અને કીર્તિ એ બાર કેઢા
જીવને અલગાવે છે જી-મ-મરણાહિના પછો.

*

પુસ્તક : ૮૮
અંક : ૬-૧૦

અધ્યાત્મ-ભાગથૃ
યુદ્ધાઈ ગોવિષ
૧૯૮૨

આત્મ સંવાદ ૬૫
વીર સંવાદ ૨૫૧૭
બિહુમ સંવાદ ૨૦૪૭

આ નું કે મ ણિ કા

ક્રમ	લેખ	લેખક	પૃષ્ઠ
૧	ધ્યાન-સાધના	મૂળ લેખક : પૂ. વિજયવદ્વાજસૂરિલુ મહારાજ સાહેબ અતુલાઙ્કા : કુમારપાણ હેસાઈ	૮૧
૨	ભવસાગર તરફા નવ નાવા નૌકા પહેલી	ધ્યાનધ્યાતા : પં. પ્રદુર્ભનવિજયલુ ગણી. અવતરણકાર : સુનિશ્ચ રાજહસાવિજયલુ મ.	૮૬
૩	પર્યાવરણ અંગે બૈનદર્શનનું માર્ગદર્શન	આયાર્થી વિજયભુવનલાલસુરીધીરણ મ સા. પ્ર. શિ. સુના અભયશોભરવિજયલુ મહારાજ	૮૬

સંસ્કૃતમાં સારા માર્કસ મેળવનારને પ્રોત્સાહિત કરવા માટે

સંસ્કૃત ભાષાના ઉત્તેજન માટે ભાવનગર કેનેશ્વ. મૂ. તપા સંઘમાંથી અને ૧૯૬૧ ની સાલમાં S. S. C. પરિક્ષામાં સંસ્કૃત વિષય લઇને અને સંસ્કૃતમાં ૮૦ ટકા અને તેથી વધુ માર્કસ મેળવીને પાસ થયા હોય તેવા દિવાર્થી લાભધ્યા અને બહેનોને પારિતોષક ધનામે આપવામાં આવ્યા હતા. સૌથી વધુ માર્કસ મેળવનાર વિધાર્થી લાભને રૂ. ૧૦૧ છનામ તરીકે આપવામાં આવ્યા હતા. બીજા નંબરે આવનારને રૂ. ૬૧ અને બીજા નંબરે આપવાને બે બહેનોને રૂ. ૮૧ આપવામાં આવ્યા હતા. બાકીના બીજા અગીયારને કુલ રૂ. ૬૨૧ આપવામાં આવ્યા હતા. કુલ સંખ્યા ૧૫ હતી. કુલ રૂ. ૬૭૫ ના રૂનામે આપવામાં આવ્યા હતા.

આ ધનામે શ્રી બૈન આત્માનંદ સભા તરફથી આપવામાં આવ્યા હતા

— ૫ —

૫. પૂ. શાયન પ્રભાવક આચાર્ય દેવશ્રી વિજયભુવનલાલસુરીધીરણ મહારાજ સાહેબ અમદાવાદ સુકામે અધાર વદ ૧૪ તા. ૬-૮-૧૯૬૧ને શુદ્ધવારના દેવ સમાધિપૂર્વક કાળધર્મ પાર્થ્યા છે.
૬. પૂ. મહારાજ શ્રીએ ૧૭ વર્ષની ૭ માર્ચે સંસ્કૃત ત્યલુને દિક્ષા અંગીકાર કરી હતી. તેઓશ્રી મહાન વિધ્વાન અને ૬મદા વ્યાખ્યાનકાર હતા. તેઓશ્રીએ ધણ્યા અંધ્યા પ્રગટ કરેલ છે એમના પ્રવચનોના સંથળો પણ પ્રગટ થયેલ છે. તેઓશ્રીના પ્રવચનો સંભળવા એ જીવનનો એક મહાન લાદ્યાવો હતો. તેઓશ્રીની જિદ્ધાંત નિધા ધણીજ અદ્ભુત હતી. તેઓશ્રીની વાણીમાં નિર્બિંડિત હતી. કેને તેમજ અનૈનો માટી સંખ્યામાં તેઓશ્રીના પ્રવચનો. ખૂબજ શાન્તિથી અને આદરથી સાંભળતા હતા. તેઓશ્રીના કાળધર્મ પામવાથી કેન સમાજને માટી જોટ પડી છે. તેઓશ્રીના શુણુનું કાર્યાલાં અર્થણું કરીએ છીએ.

પૂજ્યશ્રીજીને અમારી કાટી કાટી વંદના।

શ્રી આત્માનંદ પ્રકાશ

માનર્થતંત્રા : શ્રી પ્રમોદકાંત ભીમયંદ શાહ એમ. ઓ., બી. ટોમ, એસ. એલ. બી.



ધ્યાન - સાધના



: મૂળ લેખક :

પુ. શ્રી વિજયવલભસુરિયરણ મ. સા.

: અનુવાદક :

ડૉ. કુમારપાણ ડેસાઈ

અમૃધ્યાત્મક સાધનાનું આત્મમ [શાખર છે ધ્યાન, અના પર આરોહણું કરીને સાધક સુઝીતાના શાખરે પહોંચી શકે છે. અન્ય સાધનાની જાહેર ધ્યાન સાધન સરળ નથી, કરણું કે સામાન્ય જીવનનું જીવન માટે જાગે સાંસારિક વસ્તુઓમાં અધિક દૂષેષું ઢોખાથી તેઓ વિશેષતા: આત્મધ્યાનની જ હુય છે. અના પછી મળે છે. રૌદ્રધ્યાની, જ્યારે ધર્મધ્યાની તો બહુ જ્યાણ મળે છે અને શુક્લધ્યાની તો. વિરલ જ.

ગઈ કાંસ કે જીવાનું હતું કે માનવી કેનો અધિક પ્રાચ્ય અને સંસર્ગ કરે છે તનાથી અનામાં એવી જ જીવના જગે છે અને તહુનુસાર ધ્યાનમાં દૂષેષો રહે છે અને સ્વલ્પ, અદૃત, વૃત્તિએ અને સંસ્કાર પણ એને અતુકૂળ જ્યાણી હે છે આ કારણે જ પ્રથમ એ ધ્યાન અર્થાત આત્મધ્યાન અને નૌરૌધ્યાનના સંપર્ક અને વાતાવરણથી અયાની વિશેષ જરૂર છે અને ધર્મધ્યાન અને શુક્લધ્યાનના વાતાવરણ અને સંગતિ પ્રાપ્ત

કરવાના પણ [નિરોપ જરૂર રહે છે. પરંતુ ધર્મધ્યાન અથવા શુક્લધ્યાનના વાતાવરણને ગ્રાન્ત કરવા માટે કેટલાક એવા આધાર જેઠાંએ જેનાથી એના પર દફતાથી રહી શકાય. આના અલાવમાં આર્તોર્દ્ધ ધ્યાનનું અશુદ્ધ વાતાવરણું કે સંસર્ગ અને આડપોં ન હોય. અને જૂન જાણપદ્ધતી માનવી એ પ્રવાહમાં વહેના માંદશે વિશ્વમાં એટલા અધા જ્યારે અને પ્રદોષન છે કે આધ્યાત્મમક યાત્રીને માટે પહે પહે સારધ્યાની રાખી આવશ્યક અની જાય છે]

ધર્મધ્યાનમાં દફતાથી અહા રહેવું, અતિથ પોતાની સાધનામાં તદ્વાન રહેવું અને આત્મભાવ ચુક્લું નહીં એ આખરો ધર્ષી જ આવશ્યક છે. પાત જલી યોગદાનનમાં કહું છે,
“જ તુ દીર્ઘતર-નૈરંતર સત્કારાસ્થિતો દફનુમિઃ ।”

“ લાંબા સમય સુધી નિરંતર આદર (શક્તિ) પૂર્વક એતું સેવન કરવાથી જ એત વૃત્તિના વિરોધરૂપ યોગની ભૂમિકા દદ અનશે.

શુક્ર ધ્યાન-જાધવના માટે પણ આ જ વાત છે, કાંખાં સમય સુધી સતત અલ્પાંત શ્રદ્ધા અને આદર જાણે આ ધ્યાનમાં તદ્વિન રહેવાથી જ એ દફ ઘને છે અને ધર્મધ્યાનમાં દફતા અથવા પરિપક્વતા આવ્યા પછી જ સાધક શુક્રધ્યાનમાં પ્રવેશ હરી શકે છે, શુક્રધ્યાનના શશ્વર પર અઠવા માટે પહેલાં ધર્મધ્યાનના સેચાનો પર અઠવું અનિવાર્ય છે. હવે અમે ધર્મધ્યાનની જાધવના બાબેના ચાર સેચાન બતાવીએ છીએ.

૧. આજા-વિચય

વિચય એટલે તરંગો. ધ્યાનમાં ભનના તરંગો જ વહેતા હોય છે. અન ભગવાન હાંગો અનુસાર ક આત્માની ગતિ-મતિ થરી હોય છે તેવી ધર્મ-ધ્યાનમાં ભનના તરંગો વાર સુધ્ય તરંગોમાં પ્રવાહિત થાય છે. એમાં સર્વ પ્રથમ આજા વિચય છે.

પ્રદિક્ષણ વીતરાગ પ્રતુ દ્વારા પ્રતિપાહિત શુદ્ધ વ્યાપક સર્વદમ્ (ચાર્ડિસા, સત્ય આદિ) ની આજા-ઓષ્ઠું ચિત્તન કરવું તે આજા-વિચય છે. આપું પુરુણી આજા ધ્યાને આહુતકર હોતી નથી. પ્રદ્રગુહસ્થના પરિવારમાં જેમ ભરતા-પિતા આપું (હિતને જોનાર) પુરુષ પરિવારના હિતનો જ વાત કરે છે, ગૃહસ્થના પરિવારમાં તો કલાયત, દ્વાર્થું ક મોહન વશ થઈ સર્વહિતથી વિપરીત વાત પણ થઈ શકે છે, પરતુ જે વિદ્યપ્રેરોની, પ્રાણી માત્રાના હિતેવી અને વિશ્વવાસસ રહેતું વીતરાગ પણ છે તે તો પરમ આપું છે અનેના પોરાના હૈથી દ્વાર્થું હોય ક રાખા જગતના જુદાની અહિતકર વાત કરે ? હા, એમ જીની શરીર ક અને જીબનાર એને જુદા દ્વારા ક વિવરીત દ્વારા સમજે જાયના તો એઠું જાલાનન દ્વારે ક વિપરીત દ્વારે પ્રદ્રપણ કરે. પરતુ એઠલું ચોક્કસ છે ક જે મૂળ અન સુખ્ય વાત છે એમાં તો સમાનતા ન છે. એમાં કંઈ વિભિન્નતા હોતી નથી.

વીતરાગ પરિષુદ્ધ દ્વારા સિદ્ધાતરૂપી અખલી માલમાં કાંઈ કોળસેળ હોતી નથી એ નિખાલસ સત્ય જીથી

કે. અહુને માટે હિતકર અને શુદ્ધધર્મથી સુઠા છે. આથી પરમ આપું વીતરાગ પ્રભુની હિતકારિએ આજાઓનું સતત ચિત્તન કરવું અને તેના ચિત્તનમાં તદ્વિન થઈ જવું તે આજા-વિચય છે. આ આજાઓ પર માત્ર ચિત્તન કરવામાં આવે તો તે શુદ્ધ અને નીરસ થઈ જશે તેથી પૂર્ણ શ્રદ્ધા, ૧૬ જીવિતસ, પરમ આસ્થા અને પરમ આત્મકાળથી રહ્ય પૂર્વક એનું ચિત્તન કરવું જોઈએ એ ચિત્તનનો આવા કેમ અપનાની શકાય.

“વીતરાગ પ્રભુની એ આજાઓ અલ્પાંત ડેડા-ષ્વમાં વરવોનું વિશ્વદેષય કરનારી હોવાથી અત્યે કુશળતાભરી છે. આ આજાઓ દેશ અને કાશ્ય અનુભિત એવી સાર્વત્રિક અને સર્વકાલીન સર્વ-પ્રાણી હિતકારી હોવાથી શાશ્વત અને સર્વહિતકર છે. વળી એ આજાઓ. અનેકાત્માહના આશ્રયથી કહેલી હોવાથી પ્રત્યેક જીવેને પોતપોતાની ભૂત્ય-કાન્દી અપેક્ષાએ બતાવવામાં આવી છે. અનેકાત્માના અનુભવ કરાવનારી આ આજાઓની ડિનન આક્રી શક્ય તેમ નથી અને તેના અતાગ ઉંડાયુને માપ્યા શક્ય તેમ નથી, કોઈ પણ હિતેવી પુરુષ કાંઈ પણ નિશ્ચિંદ્ર ધર્મના સાંસ્ક્યાપોતાના વચ્ચાનાથી પણ રેખ અહિત થતી નથી કારણ કે એ આજાઓની વ્રક-પણું સત્ય છે, એને અર્થ ધર્મા ગહન અને પ્રભાવ અથવા વ્યાપક છે. એમાં પ્રતિપદ્ધ વિષય પણ ગ લીર છે એમાં કાંઈ પણ પ્રકારની બોગસેળ ક બનાવટ ન હોવાથી એ હોપરાહુન ક તમાજ પ્રાયધ નથી અને પ્રમાણું (પ્રતિદ્વાદ, અપેક્ષાએ કહુબાયેવી છે. આથી એ આજાઓની સમજાય તરીકી નથી, પરતુ દ્વારા પૂર્વક સસ્યપાણો ગરાત કરાવનું એ સમજાય છે પણ એરા અનુભવાનું આચયમાં તેવી એ આજાઓ પૂર્વભૂત વ્યાપક એ અથવા જી તેઓને એ નાના કાર્ય ન સમજાય તરીકી છે.”

આ રીત વીતરાગ આપું પુરુષની આજાઓ પર ચિત્તન-મનન કરવું જોઈ એ. અને સત્ય માનાને

ओना ५१ है आस्था। शाखों के अने अमर्त्यना प्रतिपादित तत्त्वेन्तुं चितन-भनन करुं ज्ञेषु अंगे,

कहाय योतानी मांहुद्धिने कारणे वीतराग-प्रतिपादित आजाओ। अथवा ऐतुं तत्त्व सम्बन्ध नहीं अथवा काई विषयने हेतु, उदाहरण आहिथी सरण करने आदेणामां आज्ञो। न होय अने तने पत्रिक्षये एवं विषय सम्बन्ध नहीं तो। छोड़ हैवो नेत्र ये नहीं, एवं आजाओना तत्त्वो अथवा विषयोने सम्बन्धनार काई वीतराग प्रखुना अनुग्रामी धर्मायाय कंधुयुरु गणे नहीं तो। अकाढ़ाने कं अवेशमां आवीन ते छोड़ी हैवो नेत्र ये नहीं, अथवा तो योनो भित्त्या काई वो नेत्रांनंहा कं अना पर शांकालवी नेत्रो नहीं। नाम अरदा ज चित्तर इवो नेत्रो एवं कं अत्यारे काई कारण आ तत्त्व मने सम्बन्धन नयो। तेमां नाम युक्ता हाय है, तत्त्व दर्शनवारनो नहीं। तेमां ता वर्षा, वर्षीतीवी वीतराग पुरुष है। अज्ञ, अमन अस्त्रय कुवानी जड़द रही ? अमर्त्य दश, देव अने योहने लुता लाध छ तेवा महापुरुषो ता अनुग्रामी विजितने पशु उपकार भरवा सहा तत्त्व रहेता हुता। आधी अंसनुं सहा कं अनुभव अ निनांत सद्य है, गोकालक अने वैशो-किं लत्ये ना तेमो नायुकार हुता अने तेथी ज तेजा अनताना नय, नेता अने मार्गदर्शक हुता। तेमां चाहय वाही कं पुर्णत व्याहा पर शांका लावनी अनुचित है। तेमो अर्द्धा सत्य हुता तेमो काई संहेद नयी साम वीतराग प्रतिपादित आजाओ, जिद्वांता अने तत्त्वेन्तुं डांडालूथी ६६ लिहा अने परम शक्ति साथे चितन-भनन करुं ज्ञेषु अंगे। तेम ज गृह तत्त्वानी अंसभतमां पशु काई प्रकारनो संहेद राख्या विला अने है तारे अत्य अमर्त्या नेत्रांगे। योगनी आजाओना विषय १ कुरबा, ए आजाओमा विताने «काय करुं तम ज योतानो प्रतीक वृत्ता-प्रवृत्तितु लिंगेमणुं कुं हुं कु भारी आ वृत्ता कं प्रवृत्ति वाद्रागणी आजाने

अनुदूल छ के अतिदूल ? ए अनुदूल होय लो। ओना ५२ है आस्था। आजाविषयनो विषय हे अने आ आजाविषय धर्मध्यान क्षेवाय है।

२. अपाय-विषय

‘उपाय’ चित्तयन प्राह अपायमपि चित्तयेत् (प्राज अहित विपाय विचारवानी साधासाथ अपायनो पशु विचार करे) आ उहित प्रभाषु जेम व्याज्ञ धर्म आहि उपाये। विचारे हे ते ज रीते व्यक्तिये योताना आत्माने माटे काल्य देणु अपाय अर्थात् हानिकारक हे, तेतुं पशु चितन करुं ज्ञेषु अंगे। राग, देव, कपाय, विषयोमां आसक्ति, प्रभाद, मिथ्यात्व, आश्रवेमां अविद्यति, भन, वयन, डायाना अशुब्द व्यापार आहि आत्माने माटे अपाय (हानिकारक वाभत) हे। आ अपायेना सेवनशी ज्ञेवाने आदेकमा अने परदोकमां डेवा दुष्यपरिष्काम व्योगवा पडे हे ?

आ अपायेना इलसवृप डया क्या कर्म डेवी रीते अधाय हे अने ए दैग, डष्ट, वृद्धावस्था, डःभ विला आहि इपे डया क्या क्या प्रकारे योतानो प्रभाव पडे हे ? तेम ज डेवी डेवी योनिमां ए डेवीना प्रभावे लटकुं पडे हे अने ए गति-आमां डेवा डेवा डःभे। सहेन करवा पडे हे ? आ अपायेथी प्रत्यक्ष अने परदोक डेवी डेवी हानि थाय हे ? आ अधा विशे डांडालूथी चितन करुं ते अपाय-विषय धर्मध्याननो विषय हे।

३. विपाक-विषय

विपाकेनो अर्थ हे इण, कर्मना शुभ-अशुभ इयोनुं डांडालूथी चितन करुं ते विपाक-विषय हे। आत तो आत्मा सत्य योते ज शुद्ध, युद्ध, सान, दशन अने सुख आहिथी सुकृत हे परंतु अज्ञान, दोष, ममता, स्वार्थ, रागदेव कुपाय वर्गेने कारणे थतां इमेनि लाघि चार गति अने चौर्थशी वाप योनिमां ए दानी माझक अहीं तहीं लटके हे। संपत्ति-विपत्ति, संयोग-वियोग वर्गेनेथी

थां सुभ-हुःअ शुभना पोताना पूर्वेधान्ति कर्मी (शुभ अने अशुभ) नं ज इग छे. आत्मा पोते पोताना द्वारा करारेता शुभ के अशुभ इग पासे छे सुध के हुःअ पोताना ज कृत कर्मेतुं इण छे:

पोताना कर्मी सिव-२ भीजुँ क्लाणु कोने सुध के हुःअ आरी शके छे के लघ रहे छे ? उर्मीन, केटला प्रकार छे अने ए उर्म कह कह रीते गांधाय छे ? ऐनां कोनी रिथिति केवा छे ? ए आत्मा पर कही रीते अने केवा प्रलाप पाडे छे ? आ कर्मी क्ष्यारे उड्यमां (इग लोगदा माटे) आवे छे ? ऐने अटकावा ऐचा कःया के ऐने हर करवाना उपायोः क्या क्या छे ? क्या क्या संचित कर्म सत्ता (स्टाक)मां पहार रहे छे ? आ कर्मीने अडप्याई जोगदवा देव ते ऐना क्या उपाय (उद्दीरण्या) छे ? बाढ कर्मिध कही रीते शिथित थाह रहे ? अशुभ कर्मेनो उड्य नुसमां कह रीते पर्लावः की शकाय ? क्या कार्यतुं अमुक इग छे अने क्ष्यातुं भीजुँ इग छे ? आ रीते उडाण्याथी कर्म-विपाक पर चिंतन-मनन करवुं ते विपाक-विचय धर्मध्याननो (विषय छे).

६. लोक-विचय

लोकना स्वृप्तुं चितन करवुं ए लोकविचय छे, आ लोक क्या क्या तरवेना बनेला छे ? आ लोक क्लाणु घनाठ्या छे के अनाद-अनावकाणथा प्रवाह इपै चाहेओ आवे छ ? लोकना धर्मस्तिकाय बगेरे छ द्रूय ऐक्षण्यान पर केवा प्रलाप पाडे छे ? ऐमना पर्याय केटला छे ? एन अन अल्प ऐवा ए लोकगत मुख्य तरवेतुं स्वृप्त शुं छे ? ऐनो अङ्कार कोे छे ? ए सर्वथा निय छे के अ उत्पाद (उत्पातो), वय (वनाश) अन धोब्य (स्थिति) धारवे छे ? लोक केटला छे अन उद्य लोकमां क्लाणु क्यां द्यां रहे छे ? त्यां रहेनारा ज्ञवनो स्वलाभ, स्थिति, गति, सुभ-हुःअ, देश्या (परिष्कार), प्रलाप बगेरे क्लेवे, केटलो अन क्या प्रकारना छे ए खदा कह रीते जन्म-मरण पासे

छे ? क्या लोकमां केटला अने केवा प्रकारना दीप, आभर, नाकालय, लवन, विमान, पूर्वी जेवा रहेनाना स्थान छे ? आ रीते लोकस्वृप्तुं चितन करवुं ते लोक-विचय धर्मध्याननो (विषय छे).

धर्मध्यायनना आ चार प्रकार लेया धर्मध्यायना सोपान पर चलनाराये आ चार सोपान पर दृष्टा अने सावधानीयी बहुतुं ज्ञेषु अन्ने. ऐमां लहेज पर्यु गहरत थय तो लपत्या ज समजनो, डारण के आ संसारमां चारे बजु अन्तक द्रूवाये छे. संसारी ज्ञव तो धर्मध्याय द्वीपी वृक्ष पर ची नाडि जाप तो वारंवार काम, केव्य, शवार्थ विचय-वासना बगेरे जांडा द्रूवांच्यामां पडी जावे. धर्मध्यायन द्वीपी वृक्षनो सहारो लेनार ज लोकतिमह गणनमां उहयन करीने मोक्षमां घडेची शक्षे. आ विषयमां भने जैन धतिहासतुं नार्मिक द्वाहात वाह आवे छ.

क्लारकदमेण्ड क नामना एक गुहस्थ उपाध्याय (विद्यापठ) हता तेच्या अत्यंत ज्ञानी, अद्वावान, धर्मतिमा अने वीतरागना भरा उपासक हता. ऐमनी पासे अनेक (विद्यार्थीच्या) विद्याल्यास उर्ला हता ऐमना वयु मुभ्य विद्यार्थीच्या हता ऐक हुतो राजकुमार वसु, वीजे हुतो ए उपाकायनो पुत्र पर्वत अन ग्रीवे हुतो नारद.

उपाध्याय वर्षेने ऐक ज पाठ संसारथी अलावा लाला ऐमना पर उपाध्यायनी व्यपन कुपा हता. वर्षे विद्यार्थी अल्पवामां अत्यंत परिश्रमी हता. परंतु अडेवन पणु पोतपोतानी प्रहृति, पारवती अने लालना (ध्यान) अतुसर विजिन्न इपैसां परिष्कृत थाय छे. कोई ऐना धार्मिकानमां हृपयोग करे छे तो कोई ऐनो आर्त-रोक्ष्यानामा हुक्कयोग पणु करे छे (विद्यानो सहुपयोग कर्वे) हुक्कयोग ते तो व्यक्ति पर निश्चर छे. तेथी वर्षेने विद्यार्थीज्ञानी भावतमा पणु आवुं ज थयुं.

त्रिलोक विद्यार्थींच्या उपाध्याय पासे देव आठ माझे इरुने अवश्यकी पर इरुने पाठ माडी करता होता अने पर्याय समर्पणात नाही जवा देता. एक हिंदू नियम सुखम वर्णु विद्यार्थीं पोतानी पाठ यादे शाखीने अगांशीमां सुधारण्या. उपाध्याय कीरकडीच्यक अंहर पोतानु धर्मध्यान करी रद्दा होता. आवे अभये आकाश-भागें असे आरण्यकपि शिळा उडता जवा होता. आ वात सहे? आश्रय-जनक नव्यी.

अंधायारी मुनिको पासे एवी विद्या होती ते केनी शक्तिशी तेच्या विभाननां सहायता विना त्वयं आकाशामां ऊटी शकता होता. आ अंहने आरण्यकपि अतिथ्य ज्ञानी होता.

एक व्याराण्यकपि यांने इरुने, “जुळ्या, आ अगांशी पर सूरीला विद्यार्थींच्यामां एक ब्राह्मणांची असे यीवा ते नगकरागी हे.”

आरु इरुने तो आरण्यकपि आगण वधी गया. विद्यार्थींच्या तो गाठ निरामां होता. एमने तो आ वातानी इरुनी अभय नहोती, परंतु अंहर घेऊला उपाध्याय कीरकडीच्यके आ शहर्दो सांबळया अने भेटानन विचर करवा आण्या,

“शु मारी पासे अध्ययन पामेला. विद्यार्थींच्या नरकामी याई? आ ते अनर्थ उडेवाय विद्या के विद्याहातानो होय नव्यी, परंतु येता उपर्योग करवार पर येता अधार छे. आरण्यकपियांना वाताची अंतु अतुमान अस शके के आ व्युत्तमांची अंतु अशुद्ध्यानवश भावी विद्यानी हुक्कपर्योग करणे अने एक प्रशास्तरध्यानवश सहुपर्योग करणे, परंतु ते पहेला भावे नकी हरु नेहुये के झेणु आ विद्याने सुपात्र छ अने कोणु दुपात्र? कोणु विद्यानी सहुपर्योग करणे अने कोणु हुक्कपर्योग? आवी परीक्षा परंथी अ वाणु थेशे के क्या ए विद्यार्थींच्या नरकामी छे?”

आणुगो उपाध्याये दोतानी त्रिलोक मर्दी भनावी,

अने वर्णु विद्यार्थींच्याने पोतानी पासे आवावीने इरु, “आने दृष्टी नव्यो. कोणु जुळ्ये नहीं त्यां कांगी नाखले अने पर्यायी मने यांची सोंपले”

वसु, एर्वत अने नाही त्रिलोक दोतानी मर्दी इरुने शुरु आज्ञातुं पातन करवा माटे जुही शुक्री डिसामां नीडणी पहवा

एर्वत नाव अविद्यारी अने शीदध्यान परायण करता. आज्ञा शुरुकुलाची सहेज इरु इरुने एव्हो भावे व्यादर ऊटी एमां भरथीने शुपावीने एमी गोळ भरडी नाही. काम पूरुं थतां तरत उपाध्याय पासे पाणी आण्यो.

वसु थेटा विद्यारथीव होता. ए शीदध्यानी नडोता, पखु आतेच्यानी तो होता अ. अने एव्हो रसायी होता के शुरुनी आज्ञातुं शरणक्षण; पातन करीता तो भेने इव सात्त्व राते भषुवावी अने परिवारमे मारा पिता पखु मारा पर शुश शुर्हने भेने राजगती आपशे.

वसुचे विद्यार्थीं के शुरुलुच्ये आने एकांतमां भारी नाणवातुं इरु छे एकांत नव्यी नाटे जरा आगण जाउ. ए आवता आवता एक एकांत निर्जन वनगां येतो. एव्हो आवे भाजु भराभर नेहुं के पोताने कोणु नेतुं तो नव्यी ने? पर्यायी भर्याना ए दुकडा करीने शुरुनी अने आवयो.

नाही धर्मध्यानी लुव होतो. एव्हु विद्यार्थीं, “शुरुलुनी आ आज्ञा पाणी शुं रहस्य होये? वणी शुरुलुच्ये अंवी पखु आज्ञा आपी छे के ज्यां कोळ जुळ्ये नव्यी त्यां अने भतम करशो. पखु अहीं तो पशु-पक्षी लेळ रह्या छे.

नाही आगण वधीयो. आवता आवता निर्जन वनमां एक लरोवर पासे आवयो. एव्हु नेहुं तो लरोवरना पाणी पर सूर्यना किरण्यांगत करता होता. जेवे आकाशामां नेहुं तो एने विद्यार आवयो के सूर्यदेव तो आ नेहू रद्दा छे. अहीं पखु एकांत नव्यी आव, हयांक आगण जाउ.

यातना यासता रात पड़ी गहर धनद्वार अंधारुं
अहृ गमुं, सहु कोइ निद्राहेवीनी जोहमां सूता
हुता ल्यारे नारहे मरधीने। कोइ मरहवाने विचार
कर्यो, पथु ओहु लेवुं हे आकाशमां चंद्र अने
असंख्य ताराच्यो आ लेई रह्या छे तेवी अटडी
गयो। ए गुहामां गयो अने विचारुं हे अहो
तो एकांत हे। अहो कोई पथु-पक्षी नथी, चंद्र,
तारा, वृक्ष के भानव नथी। ए गुहामां मरधीनी
डाक मरहवाने। विचार करतो हुतो लां ज थंली
गयो। गुरुल्लो कहुं हुतुं के 'ज्यां कोई लेतु न
होय लां मरधीने खतम करवी पथु अहो हुं तो
मरधीने लेई रहो हुं। आथी ए गुहानी अहर
गयो लां गाठ अंधकार हुतो, ए मरधीने लेई
लक्तो नहोतो। झुट पोताना भील अंगोने लेई
शक्तो नहोतो।

नारहनो एक नियम हुतो के कोई पथ कार्य
शह डरतां पहेला "पंच परमेष्ठि भंग" हुं उच्चार-
रणुं कहुं। आ कार्य करतां पहेला लेवुं ओहु
'नमो अरिहंताणुं' हुं उच्चारणुं कहुं। लां ज अने
विचार आयो, "अरे, मैं हुमणुं ज जन अदि-
कंतदेवतुं समरण कहुं। तेबो तो केवलज्ञानी अने
सर्वज्ञ-सर्वदर्शी छावाने कारणे अहो पथु लेता
हुशे गमे तेटला अंधारामां पथु कहुं। कहवामां
आवे तोय अमनाथी कहुं झूमुं रहेतुं नथी ज्यारे
गुरुदेवना तो आशा हुती के एकांतमां लयां कोई
न जुच्ये लां आ मरधीने मारी नाख्ने। वातराग
देव तो अहों पथु लेई रह्या छे, आथी हुं आने
अहों महीं शक्षाश नहि। अरे ! अहों तो शुं
पाताणमां जाउं तो पथु आने खतम नहीं करी
शहुं,"

नारहने माटे दिखा सर्वार्थी तो कहुं शुं ?
गुरुआज्ञानुं यातन करुं कष्ट रीते ? आवा विमा-
सखुमा विचारता विचारता रात पसार थहूं गहर
सुंदर सवार जिगी अने एकामेक नारहना चित्तमां
एक विचार वीजगणीनी माझक अमझी गयो, "कुं

गुरुनी आशा जिनआजाथी विपरीत होय शके
भरी ? ना, कही नहीं; गुरुल्लो अमारा आज्ञा-
विचार ध्याननी परीक्षा लेवा भाटे ज आ आज्ञा
आपी के, ओह ! हवे भने आतुं रहन्दय
समलयुं"।

भस, हवे शुं ? नारह अठपथी याछो। दूरवा
लायो, रातडे दिवसनो थाक पथु परम ज्ञानसुं रहन्दय
पामवाना उल्लासमां अदश्य थहूं गयुं, तो जेवी
मरधी लहने गयो। हुतो तेनी मरधी साथे गुरुल्लो
पासे पहेंदयो। धीलु खानु उपाध्याय नारहनी
राहनेता हुता, नारह आयो नहीं तेथी आणी
रात उध न आवो, नारहे आवीने गुरुल्लो
तमस्कार कर्या अने मरधीने सामे भूडी गुरुल्लो
गुस्सानो। देखाव करतां कहुं।

"अरे नारह ! तुं तो मरधी जेवी हुती तेवी
ज पाढो। लायो, ते मारी आज्ञानुं पातन केम
न कहुं ?"

नारहे कहुं, "गुरुदेव ! आपनी तो आज्ञा
हुती के ज्यां कोई न जुच्ये त्यां....

"तो शुं तन कोई जेवी ज्यारा न भणी के
ज्यां कोई लेतुं न होय ?" उपाध्याये पूछियुं,

नारह येद्यो, गुरुदेव ! हुं अषे कही आयो,
पर्वत अने वन, नदी, नाणुं के गुहा अषे ज गये;
पथु उवाय एकात मज्युं नहीं, अते अधारभारी
गुहामां जर्ज न काम 'पूंड' करवाना। विचार कर्यो,
परंतु कार्य 'पूंड' 'नमो अरिहंताणुं', तुं उच्चारणु
करता ज मन एव विचारथी आंचको लायो। हे
'अरिहंत अन सिद्ध तो। सर्वज्ञ-समदर्शी' हे,
तेबो अषुं ज लेई रह्या छे, एक नानकडे घूम्हा
पथु एमनी दृष्ट जेनाना नथी। भस, आम
विचारी हुं अटडी गये, वणी विचार आयो। के
आरहन त सर्वज्ञ लेई रह्या के। वणी एमनी आज्ञा
पथु धर्मथी विपरीत न होय। ज्यारे हिंसा वगेदे
कर्यो तो एमनी आज्ञाथी साव विपरीत गण्याय,

वीतरागनी आज्ञा विदुष कार्य करवुं एवं असत्य कहेवाय अने ओमनी आज्ञा विना कोई लुपतुं प्राणदूरणु करवुं एवं वीरी गण्याय आत्मस्वकावथी विपरीत आश्रय करवुं अथवा तो छिसा जेवा पर भावामां रभमाण रहेवुं एवं अश्रव्यर्थं छे. वणी कोई लुपता लुपता आपाणु हरवो ते मिथ्यात्व अने क्षयइप लोवाशी अंतरंग परिशुद्ध पर्यु छे आम पांचे व्रतोने लग करवो ते वीतरागनी आज्ञामां नथी अने आपनी आज्ञा वीतरागनी आज्ञाशी विदुष कोई शके ज नहि. आम विचाराने हुं अस्थीने भारी शक्यो नहीं. आपनी हुपापूर्ण अज्ञानु रहस्य पांभी गयो।”

आ सांकेतिके उपाध्याय गहगह घनी गथा अने नारहने छाती सरमे चांपता कहुं. “हे शिष्य! तुं क्योटीमां सांचे ज उत्तीर्ण थयो।”

आ रीते हुपाध्याय पांभी गथा के आ ग्रहोमां नारह ज मेक्षमानी लुप छे. ऐसु आज्ञा-विचय अद्वि धर्मध्याननुं रहस्य मेणायुं छे. वास्तवमां तो नारहन. आ काय था मन पर्यु किनआज्ञानुं रहस्य प्राप्त थयुं. हे भाई आ सांप्राप्तमां रहीने शुं करवानुं भाई रह्युं छे?

अ म विचारी उपाध्याय द्विरक्षदभके वैराग्य. पूर्ण लागती मुनि हीक्षानो अंगीकार कर्या. तेचो श्रमणु भनीने निरतियार मुख नहतुं पालन करवा लाया. आ प्रसंगमांयी आज्ञा-विचय धर्मध्याननी सुंहर प्रेरणा सांपडे छे.

यार आलंभन

धर्मध्यान प्राप्त थाय तो यु तेमां विथर रहेवुं अलंत मुर्केल छे. ज्ञे कोई आलंभन न हुय तो धर्मध्याना प्राप्ताह पर यहुं मुर्केल घने छे; आथी जानी पुरुषो एवं धर्मध्याना यार आलंभन आ प्रकारे दर्शाया छे. (१) वाचना (२) पृथ्वी (३) परावर्तना अने (४) अनुग्रेक्षा.

आ यार स्वाध्याय-तपना जेहोनुं आपणे विगते विवेचन कर्या छे, अहीं तो संक्षेपमां भाव एटलुं ज हर्षाविवुं छे के आ आलंभन कृष्ट रीते अने डेवा प्रकारे लेवुं लेई एवं अथवा तो शील-ओने धर्मध्यानमां द६ राखवा भाटे कृष्ट रीते आपवुं लेई ए.

आमां अर्वप्रथम ‘वाचना’तु आलंभन छे पूर्व-काणमां शास्त्रज्ञान कंठस्य करवामां आवतुं हुतु. आथी शुद्ध अस्थवा वीलज्ञनो पासे शास्त्र के अंथनुं श्रवण थतुं अने एवं रीते अल्यास चालतो, आथी एनुं नाम ‘श्रुत’ पह्युं परंतु ए पछी ज्ञारे शास्त्र लिपिकू थया लारे शुद्ध पासेथी एनुं रहस्य पामवा भाटे वाचना लेवामां आकती हुती. आज्ञाकाल तो भाटा भागना शास्त्र, अंथ के पुस्तकों प्रिन्टिंग ग्रेसमां छपाय छे तेथी केटलांक लोको ज्ञाने ज खास्त्र के अंथनो अल्यास करे छे, शास्त्र अथवा अंथ कोई नवलःथा नथी के जे जक्षीथी वंचाय अने तरत समज्ञ. आ भाटे वाणी साधनानी जडर छे. तेथी धर्मध्याननुं वशेष रहस्य समज्ञवा भाटे शास्त्रोनु विधिरत अध्ययन एवं ज्ञानना अधिकारी पुरुष पासेथी करवुं जहरी ए आम थाय तो धर्मध्यान द६ घने. शास्त्रो के सिद्धांतोना जांगणु पूर्वज्ञाना वाचना अक्षाने ज आजे सामान्य मानवीयो धर्मध्यानने अर्थ-कामध्यानमां पढी लय छे. वाचना लेनारहनुं एवं कर्तव्य छे के अत्यंत अद्वाक्षित अने विनश साथे शुद्ध पासेथी वाचना अहंकृष्ट करे. वाचना आपनारहनुं पर्यु ए कर्तव्य छे के जे उत्ताप स्वार्थ, सूर्णा के बदलानी भावनाथी नहीं पर्यु निर्झरा कारे शिष्यो. अने किंज्ञासुओने शास्त्रो अथवा सिद्धांतअंगानी वाचना आपे, ओमनामां धर्मध्याननो हीपैक प्रगटाववा प्रयास करे. विभिन्न देतुयो अने दृष्टांतोथी समज्ञीने ओमनामां धर्मनुराग जगाडे तेम ज आत्मोनोत्तिनी भावना वधारे. भाव पेतानुं चांडिल्य हर्षाविवा, वाहमां विजय मेणववा के प्रशसा पाम-


બાની દર્શિથી વાચના આપવી કે લોખી ને નિર્જરાતું કારણું અનતી નથી, બંદે એ અભિમાનવૃદ્ધિ ડરતાં પતનતું કારણું અને છે, મારો વ્યાખ્યાન આપવાને ઉદ્દેશ કેવળ ધર્મધ્યાનમાં તમારી રુચિ જગાડવાને છે તમારું મનોરંજન કરવું, મારું પાંડિત્યપ્રહર્ણ કરવું કે તમારી પ્રશાસા પામવાને આંદી પાછળ ગોઈ ઉદ્દેશ નથી, એથી જ આ પણ નિર્જરાતે હતું છે. આને અર્થ એ કે ધર્મધ્યાનથી ઠગતી વિકિતને મારે વાચના (જેમાં વ્યાખ્યાન પણ એક છે) ડિતામ આધારતું કામ કરે છે.

સમજણની કુડી

પૃથ્વીને અર્થ છે 'પૃથ્વુ'. કેટલીક બાબતો વિશે શાંત્વોમાં કશું લગણું હોતું નથી અથવા તો

શાંત્વાચના પછી કોઈ ખીલું બાબત અને જિજાસા વાગે લારે શુદ્ધ જન્મેને પૂછીને ચેતું કાનાધાન મેળાનવામાં આવે છે. જીવનમાં એવી ધર્મી અટપરી ક્ષમસ્થાયો, ક્ષેત્રજ્ઞ, મૂલ્યવાનું અને ગુંચ આવે છે કે જે સમયે વ્યક્તિને હોઈ માર્ગ સૂખું નથી, પરિણામે વ્યક્તિ શું કરવું અને શું ન કરવું તે વિચારી શકતો નથી અને તેથી ધર્મ-અદ્ધારીન બનાને ધર્મધ્યાનને છોડું માટે છે. આથ સમયે પૃથ્વીના એને પ્રથળ અહારો આપે છે. પૃથ્વીના દ્વારા સાધક પોતાની જિજાસાતું સમાધાન ન મેળવે તો એ નિકટ પરિસ્થિતિમાં ધર્મધ્યાનમાં દફન રહી શકશે નહીં. આથી પૃથ્વીના એક ડિતામ આબ બન છે.

(પણ આચત્તા એક)



આગને ને લાડો ન આપો તો એ એની મેળે શાન્ત
થઈ જાય છે...

અસુખ વિચારોને ને આચરમાં ન મૂંગો તો કાળકેં
એની મેળે શાન્ત થઈ જાય છે.



પરમાત્માની પસે પ્રથામ કરીને સુખમાં સહખુદ્ધિ અને
દુઃખમાં સમાધ મળો તોનો માંગણી કરવી જોઈએ.

ભગુત્તું કરું કરું

ભપસાગર તરપા

નપ નાપા નૌડા પહેલી

મહાનિર્યામક શ્રી અરિહંત મહારાજા

(નિઃ ચ: ૨૦૪૫માં દાઠા (સૌરાષ્ટ્ર) મુકામે ચૈત્રી ઓણીમાં અપાયેલા શ્રી નવપદ્મના
યાખ્યાનોનું સારભૂત અવારણુ)

ધ્યાનાત્મા :

અવનરણ્યકાર ;

પ. પ્રદુભનબિજયલ ગણુ

શુદ્ધિ શ્રી રાજહસાવન્યલ મ.

ભગુત્તું કરું કરું

પ્રથમ દિવસ : આસો સુદ ૬

કોઈયથી હોય, પરંતુ સરળતા-સંતોષ-નિરભિમાન

ધન ધનથી અરિહંતને રે જેણે

વૂતી અને ધાન્યિયવિજ્યતા આ શુદ્ધો। જરૂર આધ-

ાણાખ્યાનો લોકસદુણા

કાર્યાં જોવા હોય તો તે અરિહંત પરમાત્મામાં

તે પ્રશ્નાની પૂજા વિના ૫

જ જોવો છે. સકલ શુદ્ધોથી યુક્ત અને સકલ

જનમ શુદ્ધાખ્યો હોક સલુણું,

હોઈયથી હોય, પરંતુ સરળતા-સંતોષ-નિરભિમાન

આપણા અનંત ઉપકારી શ્રી અરિહંતા પરમા-
ત્મા અને તેઓએ સ્થાપેલ એકાત હિતકર આ

વૂતી અને ધાન્યિયવિજ્યતા આ શુદ્ધો। જરૂર આધ-

ાણાખ્યાનો પ્રાણી કરેલા જીવો અરિ-
હંતનું સ્વરૂપ આપણે તો એના પ્રત્યે રાગ

માણસોની જીવન પૂર્ણ થઈ લય,

પ્રગટ્યા વિના રહે નહિ. અને તેના કુળસરૂપે
સંસાર પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યા વિના રહે નહિ. જગ-

તમાં તમામે તમામ માણસોને શુદ્ધ પ્રત્યે પક્ષપાત

હોઈ છે કોઈ પણ માણસ શુદ્ધાની નિઃદા નહિ કરે.

તે કોઈને પણ કહો કે એક માણસે ગરીબને

પોતાના વાત અને આવાનું વગેરે આપણું, આવો

કિસ્સો સંભળ્યા પછી તેણું કેવું કાર્ય કર્યું? એ

એમ પૂછો તો સારું કર્યું એબો જ્ઞાન મળે છે.

અરેખર શુદ્ધને સર્વત્ર આહાર મળે છે. અને વ્યક્તિ

અનુભૂતિ અનુદ્ધૂતિ અની જય તે પુણ્ય.

જોત શુદ્ધ કરાર જ મળે છે શુદ્ધના પ્રકારે પુષ્ટ પણ પરકાશાનું

आपणुने आ शक्ति अने पुण्यतुं आकर्षणु छे. ए शक्ति अने ए पुण्यनो मूण स्रोत. गुणु छे. अरिहंतेतुं लेकोत्तर पुण्य छे. एना जेवुं पुण्य कोहिनुं नयो. जन्मथी वर चार, ४८- नाथो अग्नियार, ओगणीश निरधार हेवे कीदा उडार.

सविचारीसधार, पुण्यना ए प्रकार डेवा दिव्य अतिशयो. पवन मंद, शीतल सुगंधी डाय.

पण मूर्के त्वां सुवर्णु कमल डाय. आतुं पुण्य परम ऐश्वर्य गुणुमांथी आवे छे. ए क्यो. गुणु छे ? ए गुणुतुं नाम परोपकार छे. आवो एक गुणु उत्कृष्ट कक्षाए कैणवाय तो तेनी पाठण धीन घण्यां गुणु. अ.वी जय छे.

एक साथ सब साथ है ।

आ परोपकार गुणु परमात्माना तीर्थंकर देवनो अवो विकस्ये. होतो के ज्यारे तेऽनोना जन्म-हीक्षा अने डेवज्ञान कृत्याणुक वपते 'आते नरके थया अज्ञवाणा थावरने पण्य सुभक्ती' साते नरकमां कृमवार अज्ञवाणां पथराय छे. पडेला नरकमां सूर्यं जेवुं अज्ञवाणुं धीन नरकमां वाहण ढाक्यां सूर्यं जेवो प्रकाश. त्रीन नरकमां शरद 'पूर्णमां चंद्र जेवुं अज्ञवाणुं. चाथा नरकमां वाहण ढाक्या चंद्र जेवो प्रकाश पांचमां नरकमां अड जेवुं. छहा नरके नक्षत्र जेवुं अज्ञवाणुं अने सातमां नरके तारा जेवुं अज्ञवाणुं डाय अने ज्यारे अज्ञवाणुं थाय त्यारे नरकना॒ जुवो धर्षं पामे छे अने ए ए धडी सुधी क्षेत्र वेदना उपशमे छे परमाधामीना वेदना पण्य तेट्लो. भय शमी जय छे. अटलुं जगह ए ए धडी सुधीना स्वभवमा प्रखुना॒ प्रलावे झोइ नारकनो॒ जुव आयुष्यनो. अंध पडे तो ते तिर्थंय गतिनुं ना पडे. पण्य मनुष्यक्षवनुं आयु बांधे ते ज रीति तिर्थंयगतिना॒ जुव आयु बांधे तंता भनुष्यनुं आयु बांधे ते भनुष्य देवनुं आयुष्य बांधे. नरक अथवातिर्थंयनुं न बांधे. भनुष्य जे आयुष्य बांधे तो देवदोऽनुं अथवा भनुष्य गतिनुं आयुष्य

बांधे.

दूङ्कमां तमाम लुवो. सहृगतिनुं आयुष्य बांधे दुर्गतिनुं न बांधे. आवो अरिहंत परमात्मानो प्रकाश डाय छे. भूमि तो तेमना आ परोपकार गुणुनो प्रकाश छे. परोपकारथी जेवुं तो उत्कृष्ट पुण्य अंधाय छे के ने आत्माने तेऽनोना जन्म-कृत्याणुक उज्जवानो. लाल भणे ते पोतानी जलते धन्य भाने, हृतकृत्य भाने. आ अवसर्पिणीना २४ तीर्थंकर परमात्माना जन्मकृत्याणुक भेसु पर्वत उपर उज्जवाया पण्य तेमां एक लग्जवानना॒ जन्म-कृत्याणुक वपते धन्द्र महाराजा अति धर्षविसोर अन्या हुता. योदो ते क्या लग्जवान ?

सला : महावीर स्वामी लग्जवान.

ना अजितनाथ लग्जवान. डेम अधर छे श्री जग्धलदेव लग्जवान अने अजितनाथ लग्जवाननी वज्येतुं आंतरुं हेट्लुं ? पचास लाख करोड सागरो-पमतुं. होते एक धन्द्र महाराजानुं अयुष्य ए सागरोपमतुं २५ लाख करोड धन्द्र थृष्ण गया ते अधाने प्रखुना॒ कृत्याणुको उज्जवानो॒ दहावो. मज्जो डाय पण्य ने जौधर्मेंद्र महाराजा छे तेऽना॒ लस्त-झेत्रना॒ अधिपति डेवाय छे. तेऽनोना॒ क्षेत्रमां थयेला॒ तीर्थंकर लग्जवानना॒ कृत्याणु उज्जवानो॒ लाल तेमने न मज्जो. एट्ले ज्यारे आजितनाथ लग्जवानना॒ जन्मकृत्याणु उज्जवानो॒. अवसर अज्जो॒ एट्ले ए धन्द्र महाराजा॒ धर्षविसोर अन्या॒ के हुं देवो. आज्ञायाणी॒ के श्री अजितनाथ प्रखु॒ जन्मन्या॒ त्यारे ज हुं धन्द्र अन्यो॒ आ लाल भने॒ मज्जो॒.

आपणुने पण्य आवो रोमांच विसमय प्रखुनी॒ अकित करतां थनो॒ जेधुच्ये.

धन्द्रमहाराज आवी अकित करीने अभ्यक्तवने निर्माण करतां डाय छे.

आतुं पुण्य परोपकार नामना॒ गुणुथी॒ उत्पन्न थाय छे.

આવો પરોપકાર ગુણુ અરિહુંતા અનેક ક્ષવોથી દેળવતાં આવ્યા છે. ઉમાસ્વાતિલુ મહારાજ કહે છે :

‘ વ શુભકર્મસેવન ભાવિતભાવોમવેચ્વને કેષુ । અનેક ક્ષવોથી પરોપકારના ભાવથી આત્માને ભાવિત કરતાં કરતાં તેઓ તીર્થકર થાય છે, તેમને જાતનો વિચાર નથી હોતો. જગતનો જ વિચાર આવે છે ત્રિષિષ્ઠ શલાકા ‘પુરુષ અચિત્રમાં નેટનાથ ભગવાનના પૂર્વ ભવોતુ વર્ણિન છે. તેમાં આવે છે કે હરેક ક્ષવોથી પરોપકારની એક પણ તક જરૂર નથી કરતાં. આકર્માં આકરા કષ્ટ વીજિને ખીજને સુધી કરવાં હૃદી પડે છે. અને સતત દ્વારા અને લાવપ્રાણ ઉપર ઉપકાર કરે છે. કોઈની પાસે કપડાં ન હોય અને આરા કપડાં આપે, તે એક ઉપકાર અને રોગથી ઘેરાયેલા હોય તેને હવા વળેરે દ્વારા આરોગ્ય અપાવે તો તે બીજે ઉપકાર, તેમાં બીજે ચઢી જાય છે. આરોગ્ય સારું ન હોય તો વસ્ત્ર-અલંકાર આકરા લાગે છે, નકામા જણાય છે. બીજી વ્યક્તિએ કપડાં અને દવા બન્ને આપ્યા જેમાં કપડા તુરત જ દેખાય છે, કારણ કે સ્થુલ છે પણ આરોગ્ય તો એને પોતાને અનુભવ થાય ત્યારે જ માલૂમ પડે છે. કારણ કે તે સુદૃઢમ છે. હવે આરોગ્ય આપ્યા પછી સહૃદ્યુદ્ધ આપે પછી સહૃદ્યુદ્ધ આપે એ કેટલો મોટો ઉપકાર થયો. બસ, પરમાત્માએ ધર્મ સ્થાપાને જે ઉપકાર કર્યો એ આવો સૂક્ષ્મ છે. સ્થાયી છે અને સુખની પરંપરા રૂંનારો છે. ધર્મને સમર્પિત થયેલાને ધર્મ બધું જ આપે છે. એ આપણું ને પ્રિય હોય કે નહીં, પણ એને આપણે તો પ્રિય છીએ જ. તેની સાધિતી એ છે કે એ આપણું ને પ્રિય લાગે જેને આપણું આપણી પ્રિય ચીજ આપી દુધો. પ્રલુને આપણે પ્રિય છીએ એટલે તેની પ્રિયમાં પ્રિય ચીજ તીજી કરવાટ તે પણ આપવા તેઓ તૈયાર છે જે જે આપણું મનમાં તેનો ઉપકાર ભરાપર વસી જાય તો આપણું પણ આપણી પ્રિય લાગતી ચીજ તેના ચરણું ધરી દુધો. તેને ધર્મ સ્થાપાને શું નથી આપણું ? બધું જ આપણું. ધણું જ ઉપકારો કર્યા છે: આ

અરિહુંતના અનંત ઉપકારનો સ્વીકાર કરવો તે જ સાચી આરાધના છે,

આરાધના એ પ્રકારની છે : (૧) દ્રોય આરાધના (૨) લાલ આરાધના, દ્રોગ આરાધનાને ભાવ આરાધનાનું નિમિત્ત બનાવવું જેઠું. માનવમાં માન ક્ષાંય છે તેથી તે કોઇનો ઉપકાર માનતા અયકાય છે. એને એમ લાગે છે કે એમાં શું ઉપકાર કર્યો ? જે વિચારીએ તો પવન, વૃક્ષો વળેરે હરેકના પણ આપણા ઉપર ઉપકાર છે તે રીતે સંકલ કર્મના ક્ષયનું માર્ગ દર્શાન અરિહુંતે કરાંયું અને માર્ગ દર્શાવીને તો આ જાન-દર્શાન-ચારિત્રણ ધર્મ આપીને પ્રલુણે સધગું આપી દીધું છે. જ્ઞાન-સારના સંકલ પદાર્થ તેના દ્વારા જ મળે છે. જેમ હ્રદ મળે તો હૃદી ધી બધું જ મળે તેમ અરિહુંત ભગવાનના ઉપકારને માનવો ને લાલ આરાધના.

ચદ્ર, સૂર્ય, તાર, સમુద્ર અને ઝતુ વળેરેનું સંચલન સમયસર ચાલે છે તેનું કારણ ધર્મ છે માણે તેનો પણ ઉપકાર....! માતા, પિતા, ભાઈ વળેરેનો ઉપકાર અને દેવ, શુરુ, ધર્મ વળેરેનો ઉપકાર માનતા દશ્િતો એવી બની જાય કે ગજસુ-કુમારને સમશાનમાં ભાથા ઉપર જાગડી મૂક્નાર સસયાનો પણ ઉપકાર માને, કે મારા ધર્મ અપાવવામાં આ કેવું સુંદર નિમિત્ત મહિયું ? તે રીતે અધકમુનિ પોતાની જીવતી “ચામડી ઉત્તરધાખનાર રાજનો ઉપકાર માને છે. આ રીતે તેઓ અપકારાનો ઉપકાર માને છે. જ્યારે આપણે તો વાસ્તવિક ઉપકાર હેઠનારાયેનો ઉપકાર માનવાનો છે. કેટલા બધા લોકો તમારા માટે કામ કરી રહ્યા છે. કેટલા લોકોના શ્રમના લોગે તમારો એક હિવસ આરો જાય છે. ‘પરસ્પરોપથહો જીવનામ’ જીવોનો. પરસ્પર ઉપકાર થતો હોય છે. હ્રદ, પાણી, લાઈટ સમયસર મળ્ણો. જેસેછ વળેરે કરી આપે લારે તમારો હિવસ જારો જાય. દેસાસરમાં પણ પાણી લાવી આપે, ડેસર ધર્તી આપે તો. તમે પૂજા કરી શકો છો. કેટલા લોકો તમારી સેવા કરે છે. તેના ઉપકારના

સ્વીકારની તૈયારી ખરી ? તો પછી પ્રલુના સૂક્ષ્મ ઉપકારનો સ્વીકાર છરી શકાય. ઉપકાર સ્વીકારબાનો અને ઉપકાર કરવાની એક પણ તક જરૂરી નહીં કરવાની. “જસું લણે તસું કર દે ભલાઈ, જનમ જનમ સુખ પાવે – અવસર હેર હેર નહિ આવે”

આ પરોપકાર કરવાની તક વારંવાર નહીં મળે. કારણ કે એક રીતે તો પારકા ઉપર કરેલો ઉપકાર ફુળસ્વરૂપે તો પોતાના ઉપર જ થાય છે. એટલે ઉપકાર કરવાની જે તક મળે તેને ઉમળજાથી વધાની લે, ભૂખ્યાને લોજન આપે, તરસ્યાને પાહૃણી આપે, થાક્યાને વિસામો આપે, માંદાને હવા આપે-ચી એ પોતાનાથી બની શકે એટલા સુખ કે સુમાર્થ ને આપે તો તેને પણ તેટલા સુખ-સુમાર્થ મળે, હોકોમાં કહેવત છે કે “ભાગ્યા બળણો અને હાયી હરણી” આવું એકાંક્ષા ડામ તો આપા હિન્દુ જીમાં અવસ્થ કરવું જ, અંત સમયે હોઈ ને નવકાર જાંબળાંયો. હોય તો પણ તેને કેરલોં લાલ થાય ?

પરમાત્માને પણ એ માટે જ પ્રાર્થના કરવામાં આવે છે ‘જયવીયરાય’ સૂત્રમાં પહ છે – ‘પરત્ય ઇરણું પરાર્થિકરણું – પરોપકારનો ગુણું પ્રશ્ન પાસે જ માંગવ નો છે. અને તેચો જનમજ-માંતરથી પરાર્થિબસની અને પરાર્થરસિક છે. મારે તેઓની કૃપાથી તેઓનો આ ગુણું આપણુંમાં સંકાનન થઈ શકે એટલે આ મનુષ્યભવ પામાને લેટલી શરીરિત, ક્ષણું, સંપત્તિ લલાઈના કામમાં વયરાય તે જ સાર્થક છે. એક કાવચ્ય ગાયું છે ને – “ઘડી જાયે ભલાઈની મહાલક્ષ્મી ગાયી લેને” – સ્વપર જીવનને ઉલ્લંઘનાર ઉપકાર કરવો હોય તો અહીં કરી શકાય તંત્ત્ર છે. જનવરના લખમાં ધર્માં હંચાં હંશે તો પણ નાહ કરી શકો એક હાનનો જ વિચાર કરો ને ? કોઈન હાન આપણું હોય તો કયાં આપી શકાય છે ? એ જ રીતે આ મનુષ્યભવ સિકાઈ કોઈ જીવમાં ઉપકાર નહિ થઈ શકે. નરક - તિર્યાંચગાત તેના માટે નહાની છે, તિર્યાંચ ઉપકાર કરે તંત્ત્ર પણ

બિચારાની ગતિ બેની છે. એટલે અપકાર કર્યો છે તેમ સમજુને તેને માર પડે ગઢેડા ઉપકાર કરવા ગયો. ધોણીનો ઉપકાર કરવા જતાં ધોણીનો માર આચો પછેદી. હંણાં પરથાં. બાત બેની છે કે ધોણીને લાં કૂતરો અને ગધેડા બન-ને હુના. ધોણીનો કૂતરો હરનો નહિ થાટનો’ એ ન્યાયે કૂતરો એક હિંસ ભૂખ્યે. રહ્યો હોઈએ ખાવાનું આપણું નાહ તેથી રીસે ભરાયો કે આજે તંત્ત્ર માલિકનું કર્મ કરવું જ નથી. તે જ રાત્રે ધોણીના ધેર ચોર આવ્યા, કપડાં લેવા લાગ્યા. કૂતરો જુચે છે પણ બોલતો નથી. ગધેડાએ કાણું છાં બોલયો. નહિ. એટલે ગધેડાના મનમાં લાગળી થઈ અને માલિકને જગાડવા ભૂંકવા લાગ્યો. માલિક જર ઉમ્મણંદી જાણ્યો. ગધેડાનો અવાજ જાંબળાને થયું સાર્વા ગધેડા હિંસે તો જરૂર્તો નથી, રાત્રે પણ ઉંઘના હુટો નથી. તેમ બોલતો માલિક અર્થનિદ્રામાં બહાર આવી ગધેડાને એ-થાર હંણાં મારીને પાછો સૂઈ ગયો. આવું છે-માટે ઉપકાર મનુષ્યભવમાં જ હરી શક્કરો અને કોઈએ આપણું ઉપકાર કર્યો તેનો. બહલો વાળવા આપણે પણ બીજા ઉપર ઉપકાર કરાયે અને આપજુને એવા જાવ થાય કે કોઈક ઉપકાર કર્યો અને હું સુણી થયો તંત્ત્ર. તરતી સેધિના સુખમાં હું પણ નિર્મિત બતું અન કોઈએ મારા ઉપર ઉપકાર તા કર્યો જ છે. તા જેને કર્યો છે તેના ઉપકારને અને તેને ઉપકારી તરીકે હું સ્વાક્ષરું. જે એ રીતે આ જાવના પ્રત્યક્ષ દેખાતા દ્રશ્ય બ્યાંકાના ઉપકારના. સ્વીકાર કરાય તો એ જ પગદે પગદે અદ્રશ્ય એવા અરિહંતનો ઉપકાર સ્વીકારી શકીએ. હુદધથી કોઈનો પણ ઉપકાર સ્વીકારબા આમ તા સહેલો નથી. અરિહંતના ઉપકારનો સ્વીકાર કર્યી બિના આપણો ઉદ્ધાર થાય તેમ નથી. તેમજે આપણા ઉપકારી માનવા કારા એક અનુસંધાન રવાય છે, અને આટલું જેમ મજબું છે. તે જ રીતે તેઓ કારા હજુ બીજું પણ મળશે. લાઈટનો ગેળે. કદરં પ્રકાશે છે ? પાંચ હાઉસ સાથે જોકાંચ ચાલુ હોય તો કારણું

લીજળી ઇપ શક્તિનો અખૂટ બાંદાર લાં છે. તેમ અરિહંત પરમાત્મામાં અનંત શુદ્ધ-સુઅ-ચારિત્ર અને કે જાન છે તે આપણુંને જોઈએ છે, પણ તે ખુલ્લું સંસારમાંથી મળશે નહિ. તે તો અરિહંતની જાયે અનુરાગ ડેઝીને અનુભુતાન રચીએ દો તેમના અનુભુત દ્વારા તે મળશે.

‘નહિ નિષ્ઠબીજાત ઇશ્વરષિ ર્મચિતુમહંતિ ।

શેરડીનો સાંઠો દીમહિના ભીજમાંથી થાય નહિ અમૃત લરેલા કુંભથી છોને સદાયે સીંચીયે. અંધાતણું મીઠાં ઇણો. તે દીમહિ કયાંથી દીયે ???

બાવળીયે. વાવીને આંધા ફેરી શું રસ ચાંદે ? જે સંસારમાં કે તેના પદાર્થમાં સુઅ-આનંદ અને જાન છે જ નહિ લાં તેને મેળવા તમે ગને તેટલી મહેનતા કર્યા જ કરો. તો ચ મળેજ નહિ. તમે પાલીતાણુંથી અમદાવાદની ગાડીમાં એસો અને વલસાઠ-વાપીના પાઠીયા જેવા માંગો. તો તે આવે જ નહિ ને ? તેમ આ સંસારમાં વાસ્તવિક જાન સુઅ વગેરે મળતું જ નથી.

અખ્ય અકલીક છે શુભનું જાન-આનંદ રખુપ દે.... આત્મામાં જ આ જાન જાને આનંદ છે. દર્શાન અને ચારિત્રનો. અંતલીવ આનંદમાં થય છે. રમણુતા તે ચારિત્ર છે. આ જાન અને આનંદ આપણુંને જોઈએ છે તે અરિહંતની પાસે છે અને તેઓ તે આપવા તૈયાર છે. જિમ જિમ અરિહા સેવાએ ર. તિમ તિમ પગટે જાન સદ્ગુણાં.... આનો આખ લાવાને અરિહંતની પૂજા ફરીએ તો ફરીએ આનંદ આવે ? બસ આવો. જ્ઞાન જ્ઞાવવાનો છે. આબું લોકેન્ટર પ્રભુતું શાસન, દેવ-શુરુ ધ્યાન અને મહાવીરસ્વામી વગેરે ભગવાનના પ્રાર્થિન પ્રતિમા કેટલાંય કાળથી અને કેટલાય દોંડાથી પૂજાયેલા ભગવાન મળયા છે. એ હરેકના શુભ ભાવો ત્યાં સૂક્ષ્મ રીતે સ્થિર થયેલ છે. એ અધ્યા જ શુભ ભાવો આપણને તરત અસર કરે છે. ક્રી સિદ્ધાગરિના આહીંદુર હાદા પાસે જ્યારે જઈએ લારે ભૂમુખ-થાક-તરસ ખુલ્લું જ લૂલી જઈએ છીએ.

આપણું જેવા પામર પ્રાણીએ. પણ થાડા વખત માટે ખંડું લૂલી શકે છે તે કોનો પ્રલાવ ? લાં અનેક ભાવિકોના ધનીભૂત થયેલા ભાવોનો પ્રલાવ એટલે જ જ્યાનમાં એટેલાં ચોગીએને ભૂષ-તરસ અને થાક લાગતા નથી. તે વાત સમજુ શકતું છે આપણુંને પણ આરીધર હાદા પાસે સંસારની કોઈ વાત યાદ આવતી નથી. પૂજય ડ્રોપાંદ્રાયલ મહારાજ કહે છે ને, બિસર ગઈ દુવિધા તન-મન હી આચરાસુન શુદ્ધગાન મેં તેમ ચોગીએ અર્દેત ભાવને સાંઘી લે છે પરમાત્મા તે જ હું છું.

“તસ્યૈવાહ.... તવૈવાહ... ત્વમેવાહ” –

તેને જ હું છું તારોજ હું છું અને છેદલી ભૂમિ-કામાં તો તું જ હું છું; આવો ભાવ આવે લારે આનંદનો એથ ઉછળે છે લારે આંખમાંથી આનંદના અંસુની ધારા ચાલુ થાય તે જોઈને તરસ્યા પક્ષીએ. લાં તરસ છીપાવવા આવે અને ચોગીના ચોળામાં એસીને તે અશુદ્ધારાનું પાન કરે તો પણ ચોગીએને અખર ન હોય એવા તેઓ લીન હોય છે

ચોગીએના વગર એલાવે પક્ષીએ નિર્બિદ્ધ થઈન આવે છે, અહાર-અંદર, ઉપર-નીચે, આગળ પાછળ બધે જ ચોમેર આનંદ.... આનંદ છત્તાયો હોય તો પક્ષી તેમાંથી ભાકાત કેમ રહે ? એટલે વિષય-કષાયથી ભરેલા એવા આપણે પણ ભગવાન પાસે જઈએ અને થોડા કલાકો માટે ખુલ્લી જઈએ છીએ.... તો ચોગીએને આવું જાય તેમાં કંઈ નવાઈ નથી.

આહીધરહાદા જીવતી જાગતી જ્યોતા છે. કર્મશાહે અને આચાર્યશ્રી વિદ્યામહન સૂરિલુણે અન્ના પ્રતિંદા કરી છે. સિદ્ધાગરિના એ જીહિતપીઠ તો હતા જ, ગિરિરાજ અનત સિદ્ધોનું સ્થાન છે. એ જ રાયશુરુક અને એ જ હાદાનું દેરાસર, તે જ જન્માભા સમદસરણ અને જિહાસન રથાયા હશે. ભગવાન લાં પૂર્વનિવાણું વાર સમવસર્દી એના પરમાણુ હજુ પણ લાં જ છે. આવે પણ શ્રદ્ધા-વાળા એવા આપણુંને તે પરમાણુએ પછી લે છે.

‘तीर्त्थिक्यम् भक्ताने लभ्युः छे के “अहा विषु
कुण्ड ईर्दो आवे है...” ऐसी अद्भुते प्रथम
केवलानु मन आय एवं अद्भुते हरेदो प्रथम
वास्तविक परमात्माने हरेदो प्रथम छे. आ अरि-
हृतंनी शक्ति छे. आवा अर्हन्त परमात्माने नाथ
जनान्वा छे. कृष्ण कौर्त्ति द्विज आ अरिहृतं परमात्मां
विवाय होइने नाथ तरीके स्वीकारीश नहि. ‘भीज-
धर्मी भाषे श्रीमे है, कुण्ड गंगे नर एट...’

“श्रेवेकालेषसर्वस्मिन्नर्हतः समुपास्महे”

अगवान अरिहृतंपछु अत्यारे पछु भक्तिवेद
क्षेत्रमां श्री सीमधर स्वामी विचरी रहा छे.
तेऽप्यानीं कुण्डा आपथा उपर वपीं रही छे तो
आवा अगवित उपकारनो स्वीकार हरीमे ते आव
आराधना छे.

त्रिव्य आराधनामां नव आयंथीक्षणी ओणी. १२
दोग्नों डाढ़ि, १२ खमासमध्यां, १२ साथिया, २०
माणा बगेरे (डेया, परमात्माना पूजा, प्रतिकमध्य,
सामाचिक, व्याप्त्यान अवधु बगेरे हरे. नव द्विष्ट
पठमां पठरभां न पहेरे. एक धान्यानी, अदूर्धी,
मेड़ त्रिव्यानी ओणी हरे, ठाम चोविडार, पुरमहेन-
मवहडना पञ्चद्वाषु हरे एम आयंथिल न हरी
शहनारे नव द्विष्ट दीक्षितरी न वापरे, रामे न
जमे ओणीबाणी अरिहृत हरे. आ अधी त्रिव्य
आराधना आव आराधना भाटे हरे.

‘अरिहृतपह ध्यातो थडो, हृष्वच्छु पूजनाथ
है। क्षेत्र एह कर्दो आतमा, अरिहृतकृपी थाय है’
आवी हरेली आर धना इज्या चिना न रहे. श्रीपाणे
ओणी आराधना हरो हे क्षेत्री पहेलां ज द्विष्टसे
हेवो अमत्कार थयो? क्षेत्राननी पासे आरती
कितारता भगवानना औषेणामांथा थीनेहुं साधुं
काथमां आ०सुं. श्रीपाणतुं लुवहण हेहुं किताम्!
भूमेड़ा सुंहर छेय तो. अव्यामधु पछु झारुं थाय.
श्रीपाणतुं लुवहण किताम्, ओणी ज किताम् नव-
पहलानी आराधना. ते अन्नेनो रेणाप हराधनार

किताम् पात्र मध्यामा. आव्यामध्यामांहेवी निर्भयता
अने शासन माटेनो हेवो. अविहृत राय ?
मध्यामा तेना ‘पिताम् ने पछु कही हे छे केपिताम्
मत हरो जूठ शुभान’ जे चीजतुं अभिमान
हरयो. ए चीज जे ज सभजे आभीवाणी
धह जशे. ऐन माटे भनमां अेवुं विचारो. हे
आ ऐन आदी चले हे तो ते तत्त्व ज अट्टी
जशे. अट्टी जेनो. मह हर्यो तेने ते चीज हीधी
भयो छे. आ मध्यामुं शब्दित हे. मध्यामा जरी
सक्षामां अत्यथी हड्डे हे. पिताम् ! आ उचित
नवी ! लारे अ.णी जल्लामां जल्लाडो. छ्वाई गयो.
जहां पछु मध्यामा पोताना विचारने वणी रही.
निष्ठाना कारेहु ज आवा ज्ञवना संसर्गमां श्रीपाण,
श्रीधार अनी शक्या. आप्या धरनो आधार सी छे.
पहेलाना दोहो कन्या जोवा नय तो. इप हे पैसा
नहेता जेतां, पछु जानहानी जेता हुता, कारण
हे आप्या धरनो आधार हुलीन लीयो. उपर ज
हेय छे. ज गृहं ‘गृहमित्युक्तं’ गृहिणी गृह
मुच्यते’ गृहिणी धारे तेवुं धर रची शहे हे.

पिताम् ! अभिमान न हरो’ मध्यामा ज्यारे
ओतुं भोव्या ते क्षेत्रु आणी सक्षामां भाता अने
शक्षक ए ए ज राणु थाय. अवुं किताम् शिशुमध्य
अने किताम् अंस्कार मध्यामा पासे हुता. माटे तेना
ज्ञवनतुं हृष्विक्षेषु थतुं ज रहु अने मध्यामाना
संसर्गाणी श्रीपाणमां रहेली कितामता जामेन अनी
शक्ति. अधमिना धरने पछु किताम् सुखशक्षी हन्या
अंपूर्ण धार्मिक भनावी हे तेवा हायला आजे पछु
ए आरम्भेग द्वारा आ अनी शक्ति हे. अत्यारे
धर ए धर रहा ज नवी. भक्ताने ज रहा छे.
भक्ताने धर जनावनार धमना रंगे रग्येली
गृहिणी ज छे. पूर्वीनो हेडो धरने हस्तो हे,
भक्ताने नहि.

पोतानी जत हरतां धीजनो विचार अवे ते
मालुक्ष उमदा, श्रीपाणमे अधम भेणाप वधते
मध्यामानो ज विचार आण्यो. हे सुज संगे तुज

विष्णुसरो रे. सोबत जरिए होह...” श्रीपाणना आवा शब्दों सांख्यानोंत मध्यमाने आभात वाचो. शरी भक्षणां पिताल्लने कडेतां के भद्रकारी थयो न होते ते अडोल मध्यमाने ते ८ क्षेत्रे आंगु आवा ठज्ह ठज्ह आंगुडा ठो है...पितामध्यमी पाप” श्रीपाणने पूँ आवाहा दीवा विना ८ वे ८ क्षेत्रे मध्यमाने श्रीपाणना मोठे दाय लगादीने कडे छे के, “थेहु वयन [कम आलीचे, धृष्टि वयने लुँ जय कुँ सत्व ? क्ष लाकात ? ऐ बन-ने केवा आदर्शङ्गुप छे. आवड अने इपति. अ-ने तरीकेने आदर्श आपलुने श्रीपाण-मध्यमानों नेना भयो छे. अने आ ओणीनी आराधना करीने कृष्ण जैणन्युः पडेवा ८ इवसे आकृष्णु छे.

अरिहंत सतत उपकार करवा तियार छे, आपले तेने स्तीकार करवा तियार नक्षी. अरिहंते तो होएडुँ कांबाबेलुँ छे पशु आपले होएडुँ पकटवा ८ तियार नक्षी.

संक्षा : होएडुँ हेड्यातुँ नक्षी.

मोह अंधापाणा ओवा पतव आवधा कु दु, न श्री होएडुँ हेड्यातुँ नक्षी, श्रीपाण - मध्यमानी क्नोआधनाने नक्षर कामे राखीने ओवी लूरिका. तेयार कर्वी छे. तेमना नेवा अरिहंतने उपकार

स्तीकारी शडीमे तेना माटे इरय माता-पिता वर्गेरेना उपकारने स्तीकार्चो छे. जीव देशोमां पशु कौर्हि पशु मालाम कंध पशु डाम हो तो क्षे छे (तमारा आभार). तो नेवै हात-आमआधाया, नेवै रात-हिवस आपली विता हीवी, शीनामांशी सूक्तामां सुवराव्या तेवा माता-पितानो उपकार कर्वी ? अने तो पछी अनंतना माता-पिता हृप अरिहंतनो उपकार केटलो ? मा छेकरा उपर केवो उपकार करे ? केवली काणल रामे ? ओना कडतां अनंतगंगो. उपकार अरिहंतेवो धर्यो. ओमना प्रशावे ८ अहो सुधी पडेंव्या छीचे. सात राज लोक उपर आवा छीचे. अरे ! “पंथ वयवे प्रलुब्ध मन्या हृकु अरघे लावु” आपलुने आके पशु कौर्हि सारो विचार आवे छे सारुँ डाम करवातुँ भन थाय छे ते पशु अरिहंतना ग्रसावे ८ थाय छे ओम विचारीने आवी आराधनाना पडेवा दिवसे आके अरिहंतभय भनी जैहमे. तेवुँ ८ नाम, तेनुँ ८ धान, तेनी ८ वातो. छीचे. आवर्तीडाले सिद्धपदनो हिच. सिद्ध थया विना आ रक्षणपाटनो अंत आवे तेम नक्षी, ते सिद्ध थवा माटे शुँ करवुँ ? शास्त्रार अमज्जवरी, अग्रे अविकार वर्तमान.



शोकांजलि

श्री रमेशीकलाल दुर्लभदास शाह दक्षास R. D. (उभर वर्ष ६४) ता. ५ ८-६१ ना दोज लालनगर सुकामे स्कर्वासी थयेल छे. तेओश्री आ सक्षाना आशुवन सक्षय हुता. धार्मक वृत्तिवागा अने भिलनसार स्वकावना. निहर अने परोपडारी हुता. तेमना कुटुंधीज्ञनो पर आवी पडेल हुःभमां अमो. सम वेदना प्रगट हरीचे छीचे तेओश्रीनां आतमाने परम शान्ति भवे ओवी परमात्मा पासे प्रायं ना करीचे छीचे.

दा. श्री नेन अत्मानंद संक्षा
सावनगढ़.

પર્યાપરણ અંગો જૈનદર્શનનું માર્ગદર્શન

જ્ઞાન તપોનિધિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયભુવનભાતુસૂરીધરાલ મહારાજ જાહેરના
પ્રશિષ્ય મુનિશ્રી અભયશેખરવજ્ય મહારાજ

પ્રાચીનકાળમાં પર્યાપરણનો આજના કેવો હોછ પ્રક્ષ હતો નહીં એટલે એ અંગેતું સીધું માર્ગદર્શન શાસ્ત્રોમાં મળવું કઠીન છે. તેમ જ્ઞાન, જૈનદર્શનની જે વાતો પરથી ગર્ભિત રીતે પર્યાપરણની સુરક્ષા અંગેતું માર્ગદર્શન મળી શકે છે એમાંની કેટલીક વાતોને વિચારીએ.

પોતાના સ્વાર્થ માટે કરતી પ્રવૃત્તિમાં પણ બીજાઓનો વિચાર છે કે નહીં, અને જે તો હેવો છે કેટલો છે એના આધાર પર જીવોના લેશ્યાસંજ્ઞક પરિણામનું જૈન શાસ્ત્રોમાં વણ્ણન આવે છે. આ લેશ્યા પરિણામોના સુખ્ય દ્વારા પ્રકાર છે. કૃષ્ણ, ગીલ, કાપોત, તંલે, પદ્મ અને શુક્લ. આમાંની પ્રથમ કૃષ્ણ લેશ્યા અત્યાર અશુભ છે, પીળ એના કરતાં એચી અશુભ છે, ત્રીજી લેશ્યા એના કરતાં પણ એચી અશુભ છે ચાથી લેશ્યા શુભ છે, પાંચમી શુભતર છે અને છ્ફી અત્યાર શુભ-શુભતમ છે આમ જીવના પરિણામોનું દ્વિભાગોમાં વર્ગીકરણ કરીને જૈન શાસ્ત્રોમાં એવું જણાવ્યું છે કે લેશ્યા જેમ જેમ વધુ અશુભ તેમ તેમ એના પરિણામે અનેક હુદ્દો-આદ્દો આવી પડે છે. અને તેથી એવી વૃત્તિ-પ્રવૃત્તિઓ લાભ્ય છે, જ્યારે લેશ્યા જેમ જેમ વધુ શુભ તેમ તેમ એના પરિણામે અનેક સુખ સમૃદ્ધ મળી આવે છે, અને તેથી એવી વૃત્તિ-પ્રવૃત્તિઓ આદરણીય છે.

આપણી તે તે પ્રવૃત્તિમાં ક્ષેત્ર લેશ્યા પરિણામ સંભવે છે અને તેને અનુસરીને એ પ્રવૃત્તિ લાભ્ય છે કે આદરણીય છે એ આપણે સમજ શકીએ એ

માટે જૈન શાસ્ત્રોમાં જાંખુલ્લક્ષનું દિલ્લાંત આવે છે. એનો આચાર્ય આવે છે—

ભૂખા થયેલા છ પથિકોએ એક જાંખુલ્લક્ષ જેણું. એટલે એક પથિક બોલી ઉઠ્યો હે, ‘આ વૃક્ષને મૂળમાંથી ઉખેડીને પછી સુખેથી જાંખુલ્લક્ષ (કૃષ્ણ લેશ્યા) એના પર બીજે પથિક કહે છે- ‘આટલા મોટા વૃક્ષને ઉખેડી નાંખવાની શી જરૂર છે? માત્ર એની મોટી મોટી શાખાઓ છેદીએ’ (નીલ). એટલે ગ્રીજે મુસાઈર મોદ્દીએ હે ‘આવી મોટી શાખાઓ છેદાય ગયા પછી કોને અખર પછી કયારે ઉગે? એટલે એના કરતાં ક્ષેપોથી લચી પહેલી પ્રશાખાઓને જ કાપીએ’ (કાપોત). આ સાંભળીને ચોયો. કહે છે- ‘પ્રશાખાઓને કાપવાની કાંઈ જરૂર નથી, માત્ર ગુચ્છાઓન તોડીએ’ (તંલે લેશ્યા). વળી પાંચમે. પથિક કહે છે- ‘ગુચ્છાઓ તોડાની પણ કોઈ જરૂર નથી, માત્ર એમાંથી જાંખુલ્લક્ષ જ તોડી લઇએ’ (પદ્મ). છેવટે છુટો પ્રવાસી કહે છે ‘આ જમીન પર જ આટલા બધા જાંખુલ્લક્ષ એની મેળે પહેલા છે તો એ જ લઈ લઈએ, ગુચ્છાઓમાં રહેતા જાંખુલ્લક્ષને ગુચ્છાઓ પર જ રવ્યા’ (શુક્લ લેશ્યા).

આ છમાને પ્રથમ પથિક અશુભતમ કાળી-કૃષ્ણ લેશ્યાવાળોએ છે માટે આવી વૃંત્ત ત્યાજ્ય છે, જ્યારે છુટો પથિક શુભતમ શુભલ લેશ્યાવાળો છે, માટે આવી વૃત્તિ અદરણીય છે. વચ્ચા મુસાઈરો કેમશાં અશુભતર, અશુભ, શુભ અને શુભતર લેશ્યાવાળા છે, અને તદ્વારા ધીજા-ત્રાજ પથકના

વૃત્તિ પણ લાન્ય છે જ્યારે ચોથા-પાંચમાં પથિકની વૃત્તિ પણ આદરણીય છે.

બાંસુનું ઘટાદાર વૃક્ષ અનેક પથિકને છાયા અને વિશ્રામ આપે છે, કેટલાય પણીઓને આશ્રય આપે છે અને ભૂખ્યાઓને કોજન માટે બાંસુનું આપે છે. વૃક્ષને ભૂગમાંથી ઉઝેડી નાખવામાં આવે તો ફરીથી જ્યાં સુધી આતુ ઘટાદાર વૃક્ષ પેહા ન થાય જ્યાં સુધી જ્યાં આવનાર ગાથડો, પણીઓ અને ભૂખ્યાઓની શી હાવત થશે એનો કૃષ્ણ લેશ્યાવાળા પ્રથમ પથિકને ડોઈ જ વિચાર નથી, આવી વિચારશુન્યના પોતાના ભાવીને અ ઘડકાશમય કરનાર હોવાથી અનુચ્છિત છે. આ જ રૂતે થીજા-તીજા પથિકને પણ અન્ય છુયોના વિચાર ન હોવાથી એવી વૃત્તિ પણ ત્યાન્ય છે. આમ આ પ્રણ પ્રકાસીની પ્રવૃત્તિઓનો નિપેદ્ય કરવા દ્વારા જૈનશાસ્ત્રોએ ગણિત રૂતે પર્યાવરણના નાશના પણ નિપેદ્ય કરી દીધો છે. કારણું કે માનવના જે જ પ્રવૃત્તિઓ પર્યાવરણુનો નાશ કરી રહી છે જગતભર તં અધી પ્રવૃત્તિઓનો આ પરમના ઉ લેશ્યાઓમાં સમાવેશ થઈ જાય છે

આજે માનવી પોતાના અદ્યકાલીન સ્વાર્થ-જળોજલદી-સોગવિલાસ માટે જ રીતે કુદરતી જળસંપત્તિ-અનિજતેલ-વનસંપત્તિ-પણુંએ વગેરેનો નાશ કરી રહ્યો છે એવાથી પર્યાવરણુનો નાશ થઇ રહ્યો છે માનવીને ઉપરોગ માટે પૃથ્વીની ઉપરજ નાની-નાની-શરીરભર વગેરેની કુદરતી વ્યવસ્થા છે. પૃથ્વીના પેટાળમાં સંચહીત પાણીને હાથ લગાડવાનો એનો અધિકર નથી. જ્યારે કૃષ્ણજ વગેરેના કારણું ઉપરનું પાણી સૂકાઈ જાય ત્યારે નીચેના પાણીનો આવશ્યક જરૂરો પૂરતો એ ઉપરોગ કરે તે ક્ષમે ગણી શકાય. પણ એના બદલે, વર્તમાનમાં માનવી પાતાળના પાણીને એરીગ કરી કરીને એકાશપણે નિરંતર વાપરી રહ્યો છે એના કારણું એ પાણીની સયારી વધુને વધુ નીચી જઈ રહ્યી છે. એના સ્થાને સમુદ્રના ધારા પાણી બચાવા મળ્યા છે એના કારણું થોડા જ વર્ષોમાં જમીન

જેઠીને લાયક ન રહી જાની શક્યતા બિલી થઈ છે, પતાળનું આ પાણી કંઈ એન્યાર વર્ષોમાં સંચહીત થયેલું નથી. સેંકડો વર્ષોથી સંચહીત થયેલું હોય શકે છે, અને ફરીથી એને એ રીતે સંચહીત થયામાં એટલા જ વર્ષો લાગે એ સંચહીત છે. એ જાળમાં જે ઉપરા ઉપરી એ હુકળો પડયા તો એ વખતના માનવો-ઢારો વગેરેની શી હાવત થશે? કારણ કે નીચેનું પાણી પણ જ્યાં એરીગથી પણ કાંચ ચાંદી ન શકે એટલી હુદે નીચી સયારીએ હુદેચી ગયું હોય. પોતાના તુંણ સ્વાર્થ ખાતર, ભાવના સેંકડો વર્ષોના માનવીઓને ડોઈ જ વિચાર ન કરતેં જ કૃષ્ણ લેશ્યા સમાન હોવાથી પોતાને જ હુદુંખાં ગર્નાંના ધકેલી હેવા સમાન છે, અને તેથી આ રીતે પતાળના પાણીનો એક્ષ્રમ ઉપરોગ અહિતકર છે.

આ જ પ્રમાણે, જંગલો-ખનિજ તેલના ભંડારો વગેરેનો માનવ જે જડે નાશ કરી રહ્યો છે એ જડે એ નવા તૈયાર થતાં રહે એવું જોવાય મળતું નથી. લાગે, કર્ણ ગુધી સૂર્ય પ્રકાશની ગર્ભીને અદી અદીને પૃથ્વીના અંદરના ધટકો અનિજતેલ રૂપે પરિણમે છે એવું આજના વૈજ્ઞાનિકો કહે છે. લાગે. વર્ષોમાં સંચહા થયેલા તેલના આ લંડારેને માનવી માત્ર ૨૦૦ વર્ષોમાં ભાલી કરી નાખવા તૈયાર થઈ ગયો છે તો એમાં પછીના માનવોને વિચાર કર્યો? તેથી આ જડે પેટ્રોલ કાઢતા રહેલું એ શું કૃષ્ણ લેશ્યા રૂપ હોવાથી લાન્ય નથી? આ કૃષ્ણ લેશ્યા છે એમ જાણીને પેટ્રોલી. વધુને આ જડે બહાર કાઢવાનું જે અટકાવી હેવામાં આવે તો, આ જડે એ જગવાનું પણ નહીં, અને તેથી એ બળીને પેહા થતાં જેસથી જે પાણું પ્રદૂષય થાય છે એ પણ અટકી જાય, પર્યા. બરણની સુંકા થાય.

એના જાસાધણીક ખાતર નાણી નાખીને પ્રતિ વર્ષ ત્રણ પાંડ લાઠને માનવી જમીનના રશકસને ખલાસ કરું રહ્યો છે એમાં ભાવી પેહાનો વિચાર ન હોવાથી તે લાન્ય છે. આ સૂચનને નજરમાં

કેવનાં આવે તો કુળજૂપ જમીનો રણમાં હેરવાઈ જાવાના પ્રશ્નો ને ચીજો થવા માંથ્યા છે તે શારી જાય.

આમ પર્યાવરણનો નાટક કરેનાર આવા બધા વર્તનને કુણ્ણું વગેરે લેખ્યા હું જણાવી જૈન શાસને જેનો નિષેધ કર્યો છે.

આની સામે શુક્લ દેશયા આદરણીએ છે. જે જાણુંઓ સહજ રીતે જમીન પર પડેલા છ એનાથી મારું કામ નકારી લઈ, વૃક્ષ પર ગુણામાં રહેલા જાણુંને પણ ચૂંટવાની મારે શી જરૂર? એ બીજા જોના કામમાં આવશે.... બીજાના વિભાગના પ્રાધાન્યવાળી આવી વૃત્તિ-પ્રવૃત્તાના શુક્લ દેશયા સર્વરૂપ જણાવી જૈન અન્યોએ ઉપાદેય કર્યું છે. પોતે જેટલા જાણું ખાઈ શકે એટલા જાણું જમીન પર ખલ્યા જ હોય એવું કાઈ હોતું નથી તેમ જ્ઞાતાં, 'જેટલા પઢય હોય એટલાથી ચલાવી લઈશ, પણ વૃક્ષ પરથી એકેદિન નહીં તાડુ, એને બીજુંઓ માટે અકાશથી રહેવા દઈશ.' આવી જાવના આ દેશયામાં હોય છે ને એના લાવાયને પ્રાજ્ઞજ્ઞાન જ્ઞાનાબનાર છે એવું જેનદર્શન કર્યું છે.

કુદ્રત પાસેથા ને ચીજ જેટલા પ્રમાણમાં જાહેરક રીતે મળા રહેતી હોય એટલી જ ચીજનો, જરૂર પડે ત્યારે ઉપયોગ કરવો, અને કદાચ કયારેક એ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત હોય તો એટલા જ પ્રમાણથી ચલાવી લેવું એ સમૃદ્ધ અભિષ્ટહું સૂચ્યક છે આ રીતે પ્રોત્સ વગેરેનો. જે ઉપયોગ કરવામાં આવે તા એનાથી જ ગેસ ઉભયતા વગેરે ઉત્પન્ન થાય અને તા પોતાના બધાણ્ય-ઉભ્યતામાન વગેરેમા વિશોષ હેરદાર વગર પોતાનામાં જાણવાની વાતાવરણમાં ક્ષમતા હોય જ છે જંથી પર્યાવરણ સુસ્ક્ષેપ્ટ રહે છે અને ઉત્તરાસર સમૃદ્ધિઓ મળતા રહે છે.

સાધું ગણ્ણીત છે. પૂર્વનોએ ગમે એટલી સંપત્તિ એકદી કરા હોય, ઈન્કન કરતા અર્થ અધિક રાખવામાં આવું, અન એ અધિકતા સંચિત સંપત્તિ

માંથી મેળવવામાં આવે તો એક દિવસ સીખ માંગવાના હૃદાદા આવવાના જ. એ રીતે, છેવટે માનવીએ આઠલું તો કરવું જ જેઠું કે અનિજ તેથ, વૃક્ષો વગેરે જે ચીજ જેટલા ડાળમાં જેટલી નવી ઉત્પન્ન થઈ શકતી હોય એ ચીજનો એટલા ડાળમાં એટલા પ્રમાણથી અધિક ઉપયોગ કરવો નહીં.

પોતાના મર્યાદિત શક્તિઓના કારણે જે ચીજને માનવી સ્વયં ઉત્પન્ન કરી શકતો નથી એ ચીજેને જરૂરિયાત બખતે એના Source પાસેથી કદ રીતે મેળવવી જેનો ચિત્તાર પણ ગર્ભિત રીતે જૈન જાણોએ આપેલો છે.

શ્રી દ્વાર્યાકાલિક સૂત્રમાં કસ્યું છે કે— વૃક્ષ પરનાં પુણેમાથી ભ્રમર મકરંદ એવી રીતે પીણે છે કે જેથી પુણેને કોઈ હાનિ ન પહોંચે અને પોતાનું કાર્બ થછ જાય. એ રીતે સાધુંઓ, ગૃહસ્થોએ પોતાના માટે તૈયાર કરેલ લોજન વગેરે માંથી શાડી થાડી જિલ્લા લઈ નિર્વહ કરે છે, અને કોઈને હાનિ પહોંચાડતા નથી.

સીધે સીધી આ વાત સાધુંઓને લાશુ પડે છે, પણ વ્યાપક રીતે જે વેચાર કરીએ તો આમાંથી પર્યાવરણના પ્રશ્નો પણ માગં દર્શન મળી રહે છે.

ભ્રમર પોતે મકરંદ પેઢા કરી શકતો નથી તા પુણેમાથી એ રીતે મકરંદ ચૂસે છે કે જેથી પુણેને કોઈ વાધોના ન આવે. જૈન સાધુંઓ, સાધુપણુંના મર્યાદાના કારણે લોજન પોતે જનાનતા નથી, એટલે એ માટે તૈયાર સંગ્રહસ્થોના ત્યાથી લેલ્ખા લે છે. ગૃહસ્થો પાસેથી એટલું થાડું થાડું લેવું જેથા ગૃહસ્થોને કોઈ વાધોના ન આવે. ગૃહસ્થો સ્વફુલું માટે ૪૦-૫૦ રોટલી જનાની હાય અને સાધુ એમાંથી ૨-૩ રોટલા જિલ્લા તરીકે લે તો ગૃહસ્થોને કદ વાધોના ન આવે એ સ્પષ્ટ છે. આ રીતે જિલ્લા લેવી એને ગોચરી કહેવાય છે, એટલે આમાં ગાયની ઉપમા છે. ગાય જાસન ઉપર ઉપરથી એ રીતે ખાય છે કે જેથી એ મૂળમાણી ઉપકી ન જાય

અને નવું નવું આવ્યા કરે. જાયની ઉપમા દ્વારા એ સૂચન છે કે આ રીતે લિક્ષા હંમેશા માટે મળ્યા કરે છે અને દોડામાં આદરયાત્ર બનાય છે.

તેથી વિપરીત : ગધેડા બાસને મૂળમાંથી ઉઝેડી નાખે છે નેથી નવું જીગી શકતું નથી તુકશાનને લઈ ગધેડાને દોડા તિરસ્કારે છે. તેમ પર્યાવરણુને જેનાથી તુકશાન થાય તે અનાદર પામે છે.

પર્યાવરણુને રૂપર્થાતી અનેક ચીને જેવી કે પૃથ્વીના પેટળમાં રહેલું પાણી, અનિજ તેલ, વીચ જગડો, નાની-મારી વિવિધ પ્રાણીસુષ્ઠિ વગેરેને માનવી પોતે ઉત્પન્ન હરી શકતો નથી. કુદરતી રીતે પોતાની ભેગે એ ઉત્પન્ન થયા કરે છે. એટલે કુદરતને ડોઈ હાનિ પહોંચેએની સમ તુલા જોરવાધ નથી એ રીતે એનો ઉપયોગ કરવો ન જોઈએ. એ રીતે બેદ્ધમયણે કુદરત પાસેથી એ ચીને લઈ દેવામાં ગધેડાની ઉપમા છે, કુદરત માનવીને ધિક્કાર્યો, ફરીથી આપવાતું બધા કરશે અને ઉપરથી પ્રતિકુળ થઈ હેરાન કરશે. કુદરતની સમતુલા મેરવાય નહીં એ રીતે આ ચીનેનો ઉપયોગ કરવામાં સમૃદ્ધ છે એવું જણાવવા દ્વારા પર્યાવરણુની સૂરક્ષા સૂચિત થઈ છે.

શ્રી તત્ત્વાર્થસૂત્રતું 'પરસ્પરોપથઙ્ગા લુચાનામ' બચન પણ 'પરસ્પર એકધીનને ઉપથહું કરવો = સહાય કરવી એ લુચાનું લક્ષણું છે' એવું જણાવવા દ્વારા પર્યાવરણ વાગે વંધક પ્રકાશ હોય છે. કુદરતે, જાણું કે, પરસ્પર એકધીનને સહાય હોવાતું કર્તાય લુચાને સાચું છે.

ઉપલબ્ધદિયે તુકશાનકર્તા હાગે એવા શુદ્ધ-જાનું એ. પણ કંઈક ને કંઈક રીતે ઉપકારક હોય જ છે એ આજે સિદ્ધ થધ ગયેલી વાત છે. ચકલી જેવા પદ્ધીએ ધણો પાક ખાઈ જવા દ્વારા તુકશાન કરે છે એમ માનીને ચીનમાં લાખો-કરોડાની સંખ્યામાં એનો જામૂહિક સંહાર કરવામાં આંદો. બીજે વધે લગભગ ૮૦% પાડને લુચાત ખાઈ ગયું

ત્યારે ત્યાંની પ્રણાને ખ્યાલ આંદો કે આ પદ્ધી એનો સંહાર કર્યો. જુવાતથી રક્ષા કરે, ફોડા એરાક ચણી નથી છે, એના બહલામાં ડિમતી ખાતર રૂપે એ ચરકી પણ નથી છે, આ પણ એનો ઉપકાર છે. સાવ કુદ્ર કહેવાય તેવું અળસીયું પણ સેન્નિદ્રય ખાતર પૂરું પાડવા દ્વારા ઉપકારક બની રહે છે એ જગપલિદ્ધ છે આમ નાના મેઢી તમામ જીવસુષ્પિયો. કંઈ ને કંઈ ઉપકારક છે જેની હિસા કરવાના જરૂર નથો.

આ સૂત્રમાં 'પરસ્પર' એવો જે શરૂઆત છે કે આમાં એકપદી સહાયની વાત નથી. એટલે માનવે ગણું અન્ય જીવસુષ્પિને સહાયક બનવું એ જાણે કે કુદરતે એને સૌંપેલું કર્તાય છે. એના બહલે નાનવ જે પોતાના મેજાવિલાસ ખાતર પણ સુષ્પિ અને વનસ્પતિસુષ્પિનો સંહારાક બને તો કુદરત એને શી રીતે સાંઘી લેશે? બાકી તો કુદરતની આ સચોટ વ્યવસ્થા છે કે હરેક જીવસુષ્પિ કુદ્રણ જોખમ બિના લુચે. આ વાતનો નિર્ણય નીચેની આખતો પરથી કરી શક્ય છે -

(૧) લીલા પાંડા પરની જીવાતનો રંગ લીલા હોય છે. લાલ કુદ્રમાં યાતી જીવાત લાત હોય છે. કાળા કેલાસા પર થતા કંધથી કાળા હોય છે. આમાં કયાંય વિનોદખલાસ લગભગ જોવા મળતો નથી. જે વિપરીત રંગ હોય તા એ જીવાત તુર્ટ જ અન્ય ડિસ્ક જીવની નજરમાં અંગી એનો એરાક બની નથી. આમ એ જીવાતનું મરત્યુ જરૂરી થવાનો જય ઉલ્લેખ થાય જે કુદરતને મળુર ન હોવાથી હરેક જીવાતને પોતાપોતાના આધારન અનુક્રમ રંગ પ્રાપ્ત એ કુદરતા વ્યવસ્થા છે.

(૨) ઠડા પ્રહેણામાં રહેણા પ્રાણીઓની શરીર રચના એવી હોય છે કે નેથી એ ઠડા એના જીવનને દૂધાચા ન હે. એ જ રીતે ગરમ પ્રહેણોનાં પ્રાણીઓની શરીર રચના એવી થઈ છે કે નેથી ગરમી સામે રક્ષણ મળ્યા કરે. રણુપ્રહેણમાં કેટલાય હિબસો સુંધી પાવા પાણી ન મળે અન તો પણ

એ રણુ કાપવા પ્રવાસ ચાલુ રહે એ માટે ડાટના શરીરમાં પાણીનો સંથળ થઈ શકે એવી વિશિષ્ટ ગેડવણુ હોય છે. જગયર પ્રાણીઓ પાણીમાંથી પ્રાણવાયુ મેળવી લે એવું વિશિષ્ટ શસનતંત્ર એના શરીરમાં ગોઠવાયેલું હોય છે. આ બધી બાબતો પણ 'દરેક લવ પોતાનુ' લવન ટકાવી રાણે' એવી કુદરતની જાણું કે ઈચ્છા હોય એવું શું નથી જણાવતી?

(3) વિશ્વના તમામ પદાર્થો માટે એક સામાન્ય નિયમ છે કે ક્રેમ ગરમી વધે તેમ એનું કદ વધે અને ઘનતા ઘટે તથા ક્રેમ ઉષણતામાન ઘેરે છે તેમ એનું કદ ઘટે અને ઘનતા વધે ૪ સે. સુધી પાણી પણ આ નિયમને અનુસરે છે. પણ જ્યારે ઉષણતામાન એંબ ઘટવા માંડે છે ત્યારે કુદરતે પાણી પાસે આ નિયમનું ઉલ્લંઘન કરાયું છે. અને એનું કદ ઘટવાના ઘટવે વધવા માંડે છે. ઘનતા ઘટવા માંડે છે. અન્ય ફોઈ પદાર્થ દારા આ નિયમનું ઉલ્લંઘન નહીં; પાણી દારા પણ ૪ સે. સુધી જેનું ઉલ્લંઘન નહીં; અને ત્યાખાદ જ માત્ર પાણી દારા જ એનું ઉલ્લંઘન ચા માટે? આ પ્રશ્નાંની સૂક્ષ્મતાથી વિચાર કરવમાં આવે તો કુદરતની ઉપરોક્ત વ્યવસ્થા જણાવા વગર રહે નહીં.

ને પરેશોમાં ઉષણતામાન ૦ સે. કે તેથી પણ નીચું જાય છે તેવા પરેશોમાં રહેલા જગયર પ્રાણીએંબ ચલ જીવા તો જેઠું એ જ. જે પાણીનું પ્રસારણ અનિયમિત ન હોય તો, નેમ ક્રેમ ઉષણતામાન ૪ સે. થી પણ વધારે વધતું જાય તેમ તેમ ઘનતા વધવાથી ઠંડુ પાણી નીચે જાય. નીચેનું એછું જોછું ઠંડુ ઉપર આવે, એ પણ વધારે ઠંડુ પડવાથી પાણું નીચે જાય.... એમ અધું પણું ઠંડુ થતું જાય, છેવટે બરફ બનાવે ઘન થતું એથી ભલા જગયરો મુર્ખુ પાએ. કુદરતને આ માંગુર નથી તથી કુદરતે કેવી કરામત કરી! સર્વ ગઢા-દ્રોમા બાબત ઉપરોક્ત નિયમમાં અપણાદ મૂકી ૪ સે. બધી પાણું પાણીનું કદ વધારવા સાહયું,

નેથી બહારના ઠંડા વાતાવરણના સંપર્ક થી ઉપલી સપાઠી પર ઠંડા થયેલા પાણીની ઘનતા ઘટવાથી એ નીચે ન જતાં ઉપર જ રહે, આમ ઉપલું જ પાણી વધુને વધુ ઠંડુ થયા કરતાં બરફ પણ થઈ જવા જતાં એનું કદ વધું હોવાથી એની ઘનતા ઘરી હોવાના કારણે એ ઉપર જ રહે છે. વળી બરફ ઉષણતાનો આવાહક હોવાથી ઉપરના વાતાવરણની ઠંડીને નીચે જવા હેતો નથી અને નીચેના પાણીની ગરમીને ઉપર જવા હેતો નથી, તેથી નીચેનું પાણી ૪ સે. ઉષણતામાને રહેવાથી એનું પ્રવાહી ઇય જગયાઈ રહે છે અને જગયર પ્રાણી એ સલામત રીતે જીવી શકે છે.

આ બધી બાબતો પરથી આટલો નિર્ણય થઈ શકે છે કે 'દરેક લુબસ્ટ્રોએ ર્વકીય જીવન મજેથી જીવી શકે' એવી પ્રકૃતિની સચ્ચાઈ વ્યવસ્થા છે કેનો કુદરતની આ વ્યવસ્થાને માન આપે છે એના પર કુદરતની મહેર થઈ જાય છે કંને કેંચા એની સામે પડે છે એના પર કુદરત રહે છે.

આ વાતને, જૈન શાસ્ત્રોમાં, જીવદ્યા પર ભાર મૂકીને સૂચ્યેલી છે. જીવાની વધુને વધુ દ્યા યાણનારા શારીરિક સ્વાસ્થ્ય-શાંતિ-હૃદયાંશુ સાથે સર્વ પ્રકારની જમ્મુદ્ધારી પામે છે. જીવાની હિસા કરનારો એના પરિણામે રોગિક શરીર-અદ્યાયુ-હાન્ત્રિય વંગરે દુઃખો પામે છે આથું જણાવવા દારા જાણી. એને પણ પણુંએ-જીવજીતુંએ-વનસ્પતિ રક્ષા દારા માનવીના વિકાસ-સમૃદ્ધિને સૂચ્યા તે અને આ બધાના સંહાર દ્વારા વિનાશ-આપાતને સૂચ્યા છે. જીવદ્યા દ્વારા કુદરતી વ્યવસ્થાને માન આરાવાથી થયેલી કુદરતાનું અનુકૂળતા એ જ વૈજ્ઞાનિક પરિજ્ઞાનમાં પર્યાવરણની સુરક્ષા છે કંને જીવહિસા દારા કુદરતની કામે પડવાથી કુદરતનું રહેવું એ જ પર્યાવરણની નાશ છે.

વરસાદ પડે ત્યારે એક સાથે વહેં પડી જાય. નહીંતે જ પડે, અનિયમિતપણે ગમે ત્યારે પડે, અનિવૃદ્ધિ, અનાવૃદ્ધિ, દુરકાળ, વાલાઝોડું, ધર્તીકંપ

વગेरને શ્રદ્ધાળુંએ કુદરતમા ડોપતું પરિણામ કરે છે જ્યારે વૈજ્ઞાનિક પર્યાવરણના નાશતું પરિણામ કરે છે. એટલે છેવેટે કુદરતી ડોપ અને પર્યાવરણનો નાશ એક જ ગીજ છે એ સમલું શકાય છે. બળી, વિશ્વના અવસ્થિત સંચાલન માટે કુદરતે જણે કે જીવસૃષ્ટિએની એક સાંકળ રહી છે. જ્યારે કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિનો એહાદ સંહાર થાય છે ત્યારે આ સાંકળ તૂટી જવાથી અનેક ન કરીપેલી આદ્દતો સર્જય છે. આ સાંકળ તૂટી જવી એ પર્યાવરણના નાશતું જ ફીજું નામ છે. પરસ્પરોપ. અહો લુચનામ' એવું શાસ્ત્ર વચન આ સાંકળને જણવી રાખવાના સૂચન દ્વારા પર્યાવરણની સુરક્ષાનો ઉપયોગ જ જીવાયે છે.

આને ગમે એટલી શોધા થઈ, હતાં આજના માધ્યાંતા વૈજ્ઞાનિક પણ એ કણૂંવ કરે છે કે ગમે એટલી સાધનસામથીએના ખડકલા કરવામાં આવે, તેથી કુદરત (વરાઠ છે. માનવી એની અગળ વામગો) જ છે, એ કથાએક કુદરતને નાશી શકવાનો નશી. તેથી જે, કુદરતી આદ્દતોનો લોગ ન અનલું હોય તો, દરેક જીવને જીવતારાખવાની કુદરતની જે વ્યવસ્થા છે એને માન આપીને એ મુજબની જીવન પદ્ધતિ અપનાવવી એ જ શેષ ઉપયોગ છે.

ધાર્મિક આચારો હેણાઢતી વખતે શાસ્ત્રકારોની ખરીક નજરમાં આ સનાતન સત્ય અસ્તાત ન હતું. એટલે તેઓએ હેણાડેલા આચારોનું જે હુનિયા પાલન કરવા માડે તો પર્યાવરણના અધા પ્રક્રિયા હુલ થઈ જાય. વનસ્પતિની જેમ જેન શાસ્ત્રોએ હુનારો વર્ષ પૂર્વે જ પૂર્ણી, પાણી, અર્ગન અને વાયુમાં

પણ જીવ-આત્મા હોવાનું જ જીણાંદ્યું છે. જેઠાંથી પણ સુસંગત છે. અને તેથી જ આ અધાનો જેટલો બને તેટલો ઓછા ઉપયોગ કરવાનું જેન શાસ્ત્રો જણાવે છે. પાણીને ધીની જેમ વાપરધાતું જીવવામાં આંદ્યું છે. નહીના પાણીમાં ઇવાના પાણીને જેળવવાનો શાસ્ત્રોમાં નિષેધ છે તો કારા-ખાનાએતા ગંધા પાણીને જેળવવાની તો વાત જ કયાં રહે ? વનકર્મ, ધ્રગાલકર્મ હાથીદાંતનો વેપાર વગેરેનો. નિષેધ દ્વારા વનસ્પતિસુર્ષિ-પશુસુર્ષિના આદેધ નાશનો જે નિષેધ સૂચયાયે. છે એને જે માન આપવામાં આવે તો પર્યાવરણની પ્રક્રિયા જ જીવો ન થાય.

દૂંકમા, ડેઠ પૃથ્વી પાણી વગેરેથી લઈ ડીડી-મફેડા. વગેરે કુદ્ર જ જીંતુંએ. તેમજ ગાય-ભેસ વગેરેથી લઈ માનવ સુધીના તમામ જીવોની હ્યા-જીવણાની પાચા પર જેન શાસ્ત્રોએ જે જીવનપદ્ધતિ હશનિલી છે તેમાં પ્રકૃતિને અનુકૂળ રહેવાનું હોવાથી પર્યાવરણની સુરક્ષા અને ઉત્તરોત્તર સમૃદ્ધિ છે. એનાથી વપરીત, હિસાપ્રચુર જીવન પદ્ધતિમાં એ કુદરતને પ્રતિકૂળ હોવાથી પર્યાવરણનો નાશ અને આદ્દતોની વણુંઘર છે. યુક્તિ પણ આ જ વાતનું સમર્થન કરે છે. એના જીવને પીડા આપી આપીને હુઃઝી કરનારો સ્વયં હુઃઝી કેમ ન થાય? અને એનાએના સુખ-શાંતિની કાળજી દેનારો સ્વયં સુણી કેમ ન થાય?

આ લેખમાં શાસ્ત્રવચનોથી વિરુદ્ધ જ કાંઈ લખાયું હોય તેનું મિચછામિ દુષ્કરમાં...

-દેવદર્શનથી ખાબા-

"આવતો અંક"

"શ્રી આત્માનંદ પ્રદાશ" નો આવતો અંક તા. ૧૬-૧૦-૬૧ ના રોજ એ માસનો સંચુક્ત અંક બહાર પહોંચે.

Atmanand Prakash

Regd. No. GV. B 31

દરેક લાયથેરી તથા ઘરમાં વસાવવા નેવા અલભ્ય ગ્રંથો

* તારીખ ૧-૬-૮૭ થી નીચે સુખભ રહેશે *

સંસ્કૃત ગંથો	ડી. મત	ગુજરાતી ગંથો	ડી. મત
વિશાળી શાલાકા [પુરુષચરિતમ]		શ્રી સુપાર્થનાથ ચરિત્ર ભાગ ૨ લે	૧૫-૦૦
મહાકાણ્યમ् પવ' ૨-૩-૪		શ્રી કથારતન કોષ ભાગ ૧ લે	૪૦-૦૦
પુષ્ટકારે (મૂળ સંસ્કૃત)	૫૦-૦૦	આ આત્મકાનિત પ્રકાશ	૫ મ.
વિશાળી શાલાકા પુરુષચરિતમ		શ્રી જાનપ્રદીપ ભાગ ૧-૨-૩ સાથે	
મહાકાણ્યમ् પવ' ૨-૩-૪		લે. સ્વ. પૂ. આ. શ્રી વિ કસ્તુરસૂરીશરણ ૪૦-૦૦	
પ્રતાકારે (મૂળ સંસ્કૃત)	૫૦-૦૦	શ્રી સુમતિનાથ ચરિત્ર ભાગ-૧	૨૫-૦૦
કાઠશાર' નયચક્ષમ્ ભાગ ૧ લે	૮૦-૦૦	" " ભાગ-૨	૪૦-૦૦
કાઠશાર' નયચક્ષમ્ ભાગ ૨ લે	૮૦-૦૦	શ્રી નવરમરણાહિ સ્તોત્ર	૭-૦૦
કાઠશાર' નયચક્ષમ્ ભાગ ૩ લે	૮૦-૦૦	શ્રી શત્રુંજય ગિરિરાજ હરાંન	૧૦-૦૦
શ્રી નિર્માણ કેવલીભુજિતા પ્રકારણ મૂળ	૨૫-૦૦	વેરાણ્ય અરણ્ય	૩-૦૦
જિનદાર વ્યાખ્યાન	૧૫-૦૦	ઉપરેશમાણ ભાષાંતર	૩૦-૦૦
શ્રી ભાધુ સાધીની યોગ્ય આવશ્યક		ધરમ' છોશલ્ય	૫-૦૦
કિયાસૂત્ર પ્રતાકારે	૨૦-૦૦	૫૦ આગમ પ્રકારે પુષ્ટયવિજયણ	
પ્રાકૃત વ્યાકરણમ्	૫૦-૦૦	અદ્વાનલિ વિશેષાંક : પાકુ ભાઈનીંગ	૧૦-૦૦
ગુજરાતી ગંથો		આત્મવિશુદ્ધિ	૮-૦૦
શ્રી શ્રીપાળરાજનો રાજ	૪૦-૦૦	લેન હરાંન મીમાંસા	૫-૦૦
શ્રી લક્ષ્મું અને લેણ'	૫-૦૦	હું અને મારી બા	૫-૦૦
		જંબૂસ્વામિ ચરિત્ર	૧૨-૦૦

લખો :- શ્રી જૈન આત્માનંદ સભા આરગેઝટ, ભાવનગર. (સૌરાષ્ટ્ર)

તંત્રા : શ્રી પ્રમેદકાન્ત ભાગ્યંદ શાહ

પ્રકાશક : શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર.

પ્રદાન : શેષ ડેમન્ડ કરિયાન, આનંદ મી. પ્રેષ, સુવારસાદ, ભાવનગર.